



वर्ष १२ : अंक ११

अमावास : १५-८-४७

[क्रमांक १४३]

विषय-दर्शन

१. हिन्दून महिरप्रवेश अन लैनो : श्री. चीमनलाल लालखाल शे. : टाईटल पानु—२
२. रेख श्री डेक्सियाण तीर्थनो प्रश्न भूली जर्हाए ! : संपादकीय : ३१३
३. पर्मभवना अने अगडहतना चरितनी सामग्री : प्रा. दीरालाल र. शाहीया. : ३१५
४. भुवनेश्वर पासे लैन अवशेषो : पू. सु. म. श्री गानगिन्याण : ३२०
५. लैन दृश्यन : श्री. मोहनलाल दीपचंद चोकसी : ३२२
६. भारतके बाहर प्राकृतका प्रचार : प्रो. मूल्राजजी जैन : ३२४
७. खिरोडी राज्यनां डेटलांड आयीन जिनमहिरा : पू. सु. म. श्री न्यायनिन्याण : ३२७
८. श्री जिनप्रभसूरिकृतं आत्मसम्बोधकुलकम : पू. सु. म. श्री कान्तिविजयजी : ३३५
- श्रीसंघने विज्ञप्ति : टाईटल पानु—३

लवाज्ञम-वार्षिक ऐ इपिया : आ अंकनुं भूत्य-त्रणु आना

હરિજન મંદિર-પ્રવેશ અને જૈનો।

[લેખક: શ્રી ચીતુલાઈ લાલલાઈ શેઠ, બી. એ. એલ. એલ. બી.; સેલીસિટર]

સુંગાઈ પ્રાંતના મંદિરોમાં હરિજનોને દાખલ થવાનો અને પૂજા-અર્ચો કરવાનો અધિકાર આપવા યાથી ના એકટને જેને ૧૯૪૭નો લેન્ડિસ્ટ્રિક્ષન એસેન્ટ્લોનો સુસદો નં. ૨૭ સુંગાઈ સરકાર તરફથી પ્રાસદ યથેલ છે તેમાં ‘હિંદુ ડોમ’ની વ્યાખ્યામાં જૈનોને અમાવેશ કરવામાં આવ્યો છે તે વ્યાજખી નથી.

ડોમ પણ હરિજન જૈન ધર્મ પાળતા હોય તેવું અત્યાર સુધી જણ્ણુનામાં આવ્યું નથી, તેમ જ જૈન ધર્મ પાળતા હરિજનો માટે જૈન મંદિરોમાં પ્રવેશની મનાઈ કરવામાં આવી હોય તેવો દાખલો પણ બન્યો નથી.

જૈન મંદિરો હરેક જૈન ધર્મ પાળનાર વ્યક્તિ માટે ખુલ્લા હોય છે. બીજી હિંદુઓ જૈન મંદિરોમાં જૈનોની રજ (Leave and License)થી જ પ્રવેશ કરે છે, પરંતુ હજુ તરીકે તેઓ પ્રવેશ કરી શકતા નથી. જૈન મંદિરોમાં જૈન વિધિ અનુસાર પૂજા કરવાનો હજુ ઇકત્ત જૈનો જ ધરાવે છે. જૈનેતરોને આવો હજુ નથી.

જૈન ધર્મ હિંદુ ધર્મથી તહીન અનુગ ધર્મ છે, જો :કે વારાણસી, લગ્ન વિગેર યાથોમાં જૈનોને હિંદુ કાયદો લાગુ પડે છે, અત્થાં જૈન ડોમમાં પ્રયત્નિત રીતરિવાને પ્રમાણે જે હિંદુ આયદામાં કાઈ ઝેરફાર થતો હોય તો જે કાયદો રીતરિવાને પ્રમાણે જૈનો પાળતા આવ્યા છે તે જ કાયદો તેમને લાગુ પડે છે.

જૈન મંદિરો જૈનોના પૈંચાથી જ બાંધવામાં આવેલા છે અને તેનો નિભાવ પણ તેમના જ પૈંચાથી થાય છે. આ મંદિરોના અંગે જહેર પ્રજાનો અમર સરકારનો કાઈ પણ હિરસો નથી અને એ મિલકોતો જૈન ડોમની જ મિલકોતો છે; એવી મિલકોમાં છતર ડોમોને કાયદા દ્વારા હજુ આપવો એ તહીન જેરયાનખી છે એટલું જ નહિં પણ અન્યાયી છે.

તહુપરાંત હિંદું બંધારણું ધરનારી સભા અત્યારે હિંદું જે બંધારણું ધરી રહી રહ્યું છે તેમાં પણ ડોમના ધર્મમાં દાખલ નહિં કરવાની બાંહેલરી આપવામાં આવી છે.

જૈન મંદિરો ને ઇકત્ત જૈનો માટે જ હોય છે તેમાં છતર ડોમના જાસ્સોને કાયદાથી દાખલ થતાનો અને તેમાં પૂજા કરવાનો હજુ આપવો તે જરાયે વ્યાજખી નથી. જો આમ નહિં થાય તો જલિયમાં સુસ્કેલ પરિસ્થિત ઉભી થતાની સંભાવના છે. વગા હરિજનોએ જૈન મંદિરોમાં પ્રવેશ કરવાનો અને પૂજા અર્ચો કરવાનો હજુ છે તેવી માંગણી અત્યાર અમારી કદી પણ કરી નથી.

ઉપરાંત જો હરિજનોને આ પ્રમાણે હજુ મળશે તો તેઓ ભર્વાયમાં જૈન મંદિરોના વહીવટ, હિસાય દથા બીજી બાયતો અંગે ડોર્મા દાવાએ માંડી શકશે, જૈન મંદિરોના ઝર્ટીએ તરીકે દાખલ થવાની માંગણી કરશે અને જૈન મંદિરોના વહીવટ અંગે ઝખલમિરી કણી કરશે.

મારા નામ મંત્રય સુખ્ય આ અંગે સમગ્ર જૈન સમાજે આંદોલન કરી ‘હિંદુ’ શખાની વ્યાખ્યામાંથી “જૈન” શાખા કઢાવી નાંખવા ઘાસ પ્રયત્ન કરવો જોઈએ.

॥ॐ अर्हम् ॥

अस्तिल भारतवर्षाय जैन श्रेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित
श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं पासिक मुख्यपत्र

श्री जैन सत्य प्रकाश

जैशिंगभाईकी बाड़ी : धीकांठा रोड : अमदाबाद (गुजरात)

वर्ष १२	विफ्फः सं. २००३ : वीरनि. सं. ३४७४ : ६. स. १६४७	क्रमांक
अंक ११	प्रथम आवधु वटि १४ : शुक्रवार : १५ नी अगष्ट	१४३

रखे श्रीकेसरियाजी तीर्थनो प्रश्न भूली जोईए !

[सम्पादकीय]

श्री केसरियाजी तीर्थ संबंधी अति दुःखदायक परिस्थिति ऊभी थयाने आजे बे मासथी वधु जेट्टो समय वीती गयो, छतां ए सम्बन्धमां—ए दुःखदायक परिस्थितिने सुधारवा माटे—आपणे एट्टले के आखाय जैन संघे शां पगलां लेवां ए सम्बन्धी हजु सुधी कशो निर्णय लेवायो नथी ए हकीकत तरफ अमे समस्त जैन संघना सर्व आगेवानोनुं ध्यान दोरीए छीए.

कोई पण प्रश्नना निराकरणनी विचारणा माटे अमुक समयनी जखर होय ए समजी शकाय एवी बावत छे, पण ए विचारणाना समयनो पण अंत तो आववो ज जोईए ने ! के पछी आपणे विचार कर्या ज करीए अने ऊभा थयेला प्रश्नो एम ने एम पडच्या रहे ! जो आम ज थाय तो तो दीर्घसूत्री विनश्यति (केवल लंबा लंबा विचारो ज कर्या करनार छेवटे विनाशने ज पामे) जेवी हालत थया वगर न रहे ए वात आपणे न भूलीए.

अमने लागे छे के आ प्रश्नना निराकरण माटे हवे तो पूरतो समय वीती गयो छे, अने हवे एमां जे कहै वधु कालक्षेप थशे ते संघना कल्याणने हानि पहाचाड्या वगर नहीं रहे. एट्टले हवे तो आखा संघे एकदिल अने एकलक्षी बनी आ माटे एक या बीजो—योग्य लागे है—मार्ग निश्चित करोने ए मार्गे कुचक्कदम करवानी आखा जैन समाजने आज्ञा आपवी जोईए. आम नहीं थाय तो दुःखनुं ओसड दहाडा ए कहेवत प्रमाणे अमुक समय वीतशे एट्टले आपणी बेदना भुलाई जशे अने आपणा एक प्राणप्रिय तीर्थना रक्षणनी आपणी तमचा नामशेष शई जशे थ्यने परिणामे आपणा एक महातीर्थने आपणे आपणी आळस के निष्क्रियताना कारणे गुमावी बेसीझुं.

कोई पण प्रकारनी आफत आवे ए कोईनेय इष्ट तो न ज होय, पण जो आफत आवी ज पढी तो पछी ए आफतमाथी संघ—संगठन साधवानो लाभ आपणे अवश्य मेल्हवी लेवो घटे;

३१४]

श्री जैन सत्य प्रकाश

[वर्ष १२

आवा संकट—समये पण जो आपणे संगठित थवा तैयार न होईए तो तो पछी आपणे ऊजळा भविष्यनी आशा ज शी रीते राखी शकीऐ ?

जावाल, तळाजा के श्री केसरियाजी तीर्थ जेवा प्रसंगो ए आपणी संघशक्तिनी कसोटीना प्रसंगो बन्या छे, एवा प्रसंगे आपणुं संघ—शरीर केटलुं सबल के निर्बल छे, एनुं निदान अचूकपणे जाणी शकाय. १०—२० वर्षना नजीकना भविष्यमां ज जैन संघ—जैन समाज उपर जे कर्दै वीती गयुं छे ते जोतां आपणुं समाज—शरीर दुर्बल थई गयुं छे अने दिवसे दिवसे वधु जर्जरित बनतुं जाय छे ए दीवा जेवुं स्पष्ट छे. आपणी आ वर्तमान हालत अने आपणो भव्य भूतकाळ ए बेनो विचार करीए छीए त्यारे क्षणभर मनमां थई आवे छे—शुं आपणे ए ज जैन महाप्रजाना संतानो छीए के जेमना पूर्वजोए मोटां मोटां देवालयो अने धर्मालयो ऊभां कर्यां हत्ता, मोटां मोटां राज्योनुं संचालन कर्युं हत्तुं, मोटां मोटां रणांगणोमां वीर हाक गजवी विजय वरमाळ पहरी हत्ती, अने राष्ट्रना दरके दरेक क्षेत्रमा पोतानुं वर्चस्व दाखवी पोतानी तुद्धि अने शक्तिनो सौ कोईने लाभ आप्यो हतो ?

आपणुं तीर्थ एटले आपणुं पोतानुं ज एक अंग, ए अंग उपर घा उपर घा थता होय अने छतां आपणुं दिल ठंडी ताकात दर्शाववा तैयार न थाय के ए घानी सामे बंड पोकारी न ऊठे अने ऊलटुं आपणे शून्यचित्त जेवा बनी जईए त्यारे नथी लागतुं के आपणे निष्क्रिय, निश्चेतन अने हीनसत्त्व बनी रह्या छीए ?

श्री केसरियाजी तीर्थ अंगे ऊमो थयेलो प्रश्न ए केवल केसरियाजी तीर्थ पूरतो ज छे एम रखे आपणे मानी लईए ! आजे आ प्रश्न आवी पड्यो तो काळे बीजो नहीं आवी पडे—आपणा बीजा तीर्थ उपर पण आफत नहीं आवी पडे—एनी शी खातरी ? अमने तो लागे ज छे के आजे जो आनो ताकात पूर्वक प्रतीकार नहीं करीए तो आवती काल आथीय वधु वेरी आफत ऊतर्या वगर नथी रहेवानी. जे शरीर उपर एक रोगे हुमलो कर्या एना उपर बीजा रोगोने हुमलो करवानुं साव आसान छे ए रोजना अनुभवनी वात आपणे कां भूलीए ? पण आमा दोष रोगनो नहीं पण कमजोर शरीरनो ज गणाय. हवे ए घडी आवी लागी छे ज्यारे आपणे ए वातनों केंसलो करवो ज पडवानो छे के आपणा दुर्बल बनेला संघ—शरीरने आपणे वधु दुर्बल बनाववा मागीए छीए के ए दुर्बलताने खंखेरी नाखीने ए संघ—शरीरने सशक्त अने बलवान बनाववा मागीए छीए. श्री केसरियाजी तीर्थ जेवा प्रश्नोए ए दुर्बलता फगावी देवानो आपणने सुयोग मेलवी आप्यो छे, ए सुयोगनो लाभ लेवानुं आपणे न भूलीए अने प्रसंग ज्यारे आवी ज पड्यो छे त्यारे एवी शक्ति दाखववानुं न चूकीए के जेथी भविष्यमां बीजी

अंड ११] धर्मभवना अने अगडहत्तना चरित्रनी सामग्री [३१५
 कोई पण व्यक्ति जैन संघ उपर—जैन सघना कोई पण अंग उपर—आकमण करवाने विचारं
 सुदर्दा न करे. अस्तु !

दूँकमां—आ प्रसंगे भार दर्हने जे काँई कहेवानुं प्राप्त थाय छे ते ए ज़’छे के हवे आमा
 बहु बहु विचारो कर्या करतां काँईक नकर अने सक्रिय कार्य आपणे करीए. सम्भव छे के
 आ माटे अन्दरखाने काँईक प्रयत्नो चालता पण होय. एम होय तो एमांनी समाजने जणावी
 शकाय एवी हकीकत थोडे—घणे अंशे पण समये समये प्रकट थती रहे ए अत्यन्त जखरी
 अने इष्ट छे. एम थाय तो ज जनताना दिलमां काँईक धरपत रहे अने आपणा आगेवानो के
 आपणी आगेवान संस्थाओ आ सम्बन्धमां जे काँई पगलां लेता होय तेना सारासारपणानो
 ख्याल जनताने आवी शके अने ए सम्बन्धमां जनताने काँई कहेवा जेवुं लागे तो ए कही
 पण शके, आखरे संघ एट्ले तो ए जैन जनता ज गणाय ने !

बाकी अत्योरे तो आ प्रवृत्तिनुं जे बाद्य दर्शन थर्ड रह्युं छे तेथी तो मनमा दिलगीरी
 ऊपजे एवुं ज छे. आनुं परिणाम तो धीमे धीमे आ प्रश्नने वीसरी जवा सिवाय बीजुं भाग्ये ज
 आवे. अमने तो पूरो पूरो भय लागे छे—अने तेथी ज अमे आटला भारपूर्वक कहीए छीए छे
 — के आ गतिथी आपणे आपणुं ध्येय सिद्ध नहीं करी शकीए, अने आपणा जीवन—मरण
 समो एक प्रश्न आपणे वीसरी जईगुं. अमारो ए भय खोटो निवडे एम इच्छीए.

धर्मभवना अने अगडहत्तना चरित्रनी सामग्री

(ले. ग्रा. हीराज्ञाल २. कापडिया एम. ए.)

कथायेना, किसायेना, कहायेना, वातीयेना अने चरित्रेना विविध प्रकारेना
 उत्तम नभूतायें पूरा पाउनार तरीके आरत्यर्पे भुप्रभिक छे. कथाद्दने लभतुं भारतीय
 साक्षिय धथ्यु छुच्य क्लाइट्टनुं छे अने एमा लैनोनो जेवा जेवा धाणा भयी वसुहेवहिंडी
 ए नाभयी जाखीती अयेली कथा लेवी कथा डेट्ली छे ? ए विचारनारने आ
 अहेने समझेये.

आपणी मुं अर्ध विद्यापीठना अक्षिनव अन्यासकम भ्रमाल्ये अन्यास उरनारा प्रथम
 वर्षना तेमज्ज धी. ए.ना धीन वर्षना विद्यार्थ्याने आ वर्षे अनुक्ते अगडहत्तचरित्र
 अने धर्मभवनहिंडीनो अन्यास करवानो छे, तो अने अंजेनां आधनोनो निहेंश करवा
 भाए तेमज्ज “अर्ध” भागधी” तरीके विद्यार्थ्याने शुं शीखवाय छे ते इक्कीवरा आटे
 आ लधु लेख लाखाय छे.

पाठ्यां “धर्मभवन” अने “धर्मभेद्य” शेवा ऐ जाह्नो छे. ए अनेने भारेनो अंसूत
 शुभ्द “धर्मभवन” छे, अना जांयत—प्रधिका डेख अने एक लैन मुनि एम ऐ अथो छे.
 धीने अर्थ अत्र प्रस्तुत छे.

૩૧૬]

શ્રી નૈન સત્ય પ્રકાશ

[૧૫૮ ૧૯]

વાગ્ક સંદેશાસનગુણો વિ. સં. ૬૬૬ કરતાં તો ધખું વર્ષો પૂર્વે રચેલ અને મહત્તર ધર્મસેન ગણિએ પૂર્ણ કરેલ વસુદેવહિંડીના પ્રથમ ઘંડમાં કથોતપ્તિની પછી 'ધર્મભદ્રહિંડી' યાને 'ધર્મભક્તયરિય' છે. આ બી. એ. ના. બીજા વર્ષના વિદ્યાર્થીઓને આ વર્ષે શીખવામ છે. ધર્મભક્ત જ્યારે જરૂર્માં હતો ત્વારે એની માતાને ધર્મ કરવાનો દોઢદ થયો હતો એ ઉપરથી એનો જન્મ થતાં એનું નામ 'ધર્મભક્ત' રખાયું એમ ધર્મભક્તહિંડીમાં હલ્દેખ છે.

આવસ્સયની નિનજુટિ (આ.ઠ. ૧૬૨૦)માં 'ધર્મભક્ત' એવું નામ છે; બાકી એનું ચારન નથી.

શકસવત્પદ પદ્ધતમાં ન'દીચુણિષ્ટ રચનારા જિનદાસમણું મહત્તરે રચેલી મનાતી આવસ્સયચુણિષ્ટ (ઉત્તર કાળ, પત્ર ૩૨૩-૩૨૪)માં નીચે સુનના હલ્દેખમાં ધર્મભક્તના ઉદાહરણુંનો નિર્દેશ છે—

"શ્યામિં ફલે । તં દુવિહં । ઇહલોપ ધર્મિલોદાહરણં, જહા વસુદેવહિંડાપ ।"

અથોત્ હવે ઇણનો વિચાર કરીશું. એ એ પ્રકારનું છે. આ લોકમાં ઇણ મેળવનાર તરીકે ધર્મભક્ત(દ્વારા)નું ઉદાહરણ જાણું કે ને વસુદેવહિંડીમાં અપાયું છે.

આવસ્સય અને એની નિનજુટિ ઉપર યાહિની મહત્તરાના ધર્મસત્તુ તરીકે સુવિષ્યાત હુરિદાસરાયનો સંકૃતમાં વિસ્તૃત ટીકા રવી છે. એના ૮૬૩અ પત્રમાં ધર્મભક્તનું ઉદાહરણ ધર્મભક્તહિંડીમાંથી જાણું એમ એમણે કહ્યું છે.

ધર્મભક્તહિંડી કરતાં ડાઈ પ્રાચીન કૃતિ ધર્મભક્તનું અરિત્ર પૂર્ણ પાડતી હોય તો તે જાણુંવામાં નથી, કેમકે વસુદેવહિંડીના પ્રારંભમાં કહ્યું છે તેમ પદ્ધતમાણુંઓઅ (પ્રથમાનુંઓઅ)માં વર્ષુંવેલ વસુદેવચારયને એ આભારી છે અને આ અનુયોગ આને આપણું ઉપલબ્ધ નથી.

'અ'ચળ' અચળના અહેન્દ્રપ્રભસુરિના શિષ્ય જીવરોભરસૂરિએ ગુજરાતમાં વિ. સં. ૧૪૬૨માં જંસ્કૃત લાખામાં ધર્મભક્તદશચયરિત્ર નામનું રચિક કાબ્ય રચ્યું છે અને એ હીરાલાલ હંસરાજ તરફથી ધખું વર્ષો પૂર્વે પ્રચિક થયું છે. ત્યારાણ એની બીજી આવૃત્તિ બહાર પડી. ત્રીજી આવૃત્તિ મનસુખલાલના ગુજરાતી ભાષાનાતર અહિત પ્રત આકારે ચાર

૧ આનો અર્થ 'ધર્મો' એમ થાય છે. પાછયમાં 'માલકી' બતાવવાના અર્થમાં આખ, આલુ, ધર્તા, ધર એમ ને વિવિધ અનુગ વપરાય છે તેમનો એક તે 'ધૂલિ' છે. ધર્મ+ધૂલિ=ધર્મભક્ત.

૨ આ રહી એ આથા:—

'પચ્ચકલાણસ્સ ફલે ઇહ પરલોપ અ હોઇ દુવિહં તુ ।

ઇહલોપ ધર્મિલાહ દામજનગમાઈ પરલોપ ॥૧૬૨૦ ॥

આનો અર્થ એ છે કે પ્રત્યાખ્યાનતું ઇણ આ લોકમાં અને પરલોકમાં મળે છે એ હિસાએ એ એ જાતનું છે. ધર્મભક્ત વગેરેને આ લોકમાં ઇણ મળ્યું છે, જ્યારે દામજન વગેરેને પરલોકમાં મળ્યું છે.

અંક ૧૧] ધર્મભલના અને અગડહતના ચરિત્રની સામયી [૩૧૭
ભાગમાં છપાવાઈ અને ચોથી આવૃત્તિ ભૂળ અને ભાષાનંતર સહિત પુસ્તક આકારે વિ.
સં. ૧૬૮૫માં વીઠલજી હીરાલાલ લાખન (ગમનગર) તરફથી પ્રસિદ્ધ કરાઈ.

આ ધાર્મભલચરિતમાં ૩૫૦૩ પદ્ધો છે, જ્યારે એની પ્રશ્નસિતમાં ૩૫૦૪ હેઠાનો ઉદ્દેશ છે.

૧૮મા પદ્ધમાં કહું છે કે દ્વારા મનુષ્યને સર્વ જરૂરિતાઓ મળે છે. એનું સાક્ષાત્
ઉદ્દેશ્ય તે ધર્મભલ છે. આમ કહી જેમનું ચરિત્ર અપાયું છે. આમાં અગાલ(૬)દરતું
ચરિત્ર આડકથાદ્યે અપાયું છે.

કર્તાના નામ તેમ જ રચનાવર્ષના ઉદ્દેશ વિનાની એક સંસ્કૃત કથા ‘ધર્મભલકથા’
એ નામથી “નૈન આત્માનન્દ સભા”એ વિ. સં. ૧૬૭૧માં પ્રસિદ્ધ કરી છે. એમાં ૨૧૪
પદ્ધો છે. અંતમાં નાચે સુભજનો ઉદ્દેશ છે કે એ કથાની પાછળ રહેલો હેતુ
શુચવે છે:—

‘ઇતિ હાહલોકાર્થાત્પ્રભાવે ધર્મિલકથા’

આ કથાનું વાસ્તવિક નામ ‘ધર્મભલકથા’ હેતું જોઈએ.^૧ એની હાથપોથી તપાણાય
તો એ વિષે નિર્ણય થઈ શકે. આકી આ કથા ઉપર્યુક્ત ધર્મિલહિંદાનો સંસ્કૃતમાં સારાંશ
છે એ તો નિર્વિવાદપદ્ધે કહી શકાય તેમ છે.

ને. સા. સં. ઈ. જોતાં જણાય છે કે સૌભાગ્યહૃદરિના શિષ્ય સોમવિમલસુરિએ
વિ. સં. ૧૫૮૧માં ગુજરાતીમાં ધર્મભલરાસ રચ્યો છે. જૈન. ગુજરાત કલિયોમાં પણ
આ ઉદ્દેશ છે. વિશેષમાં અણી ધર્મભલને અગે એ કૃતિઓ નેંઘાઈ છે: (૧) જ્ઞાનસાગરે
વિ. સં. ૧૭૧૫માં ધર્મભલરાસ રચ્યો છે અને (૨) વીરવિજયે વિ. સં. ૧૮૮૫માં
ધર્મિલહુમાર રાસ રચ્યો છે. આ બીજા રાસમાં લગ્નભગ “વસુદેવહીંડે કલો” એવો
ઉદ્દેશ છે.

ધર્મિલહુમાર યાને જાગતો પુષ્ટ્યપ્રભાવ એ નામનું એક પુસ્તક ૭૨ પ્રકારથુભૂ
રચાયું છે. એનાં શુદ્ધાતાની પાની વગરનું પુસ્તક મારા જોવામાં આવ્યું છે. એટલે કલી
વિષે વિષે હું કંઈ કહી શકતો નથી.

વસુદેવહીંડીના પ્રથમ ખંડનું હાલમાં “નૈન આત્માનન્દ સભા” તરફથી ગુજરાતી
ભાષાનંતર અહાર પડયું છે. એ ધર્મભલહીંડીના અભ્યાસીને ઉપરોગી થર્ષ પડશે તેમજ સાથે સાથે
ધર્મભલનું પ્રાચીનમાં પ્રાચીન ચરિત્ર પણ ગુજરાતી વાચકોને એ પૂરું પાડશે. આ સભાએ જ્યારે
આ મહાકાય ધર્મકથાનું ભાષાનંતર પ્રસિદ્ધ કરવાનું રહુત્ત પરમાણું ભર્યું છે તો વિમલસુરિની
પહીમચચિયા^૨ (પદ્ધયારિત) અને સુપ્રાચિદ હીરભદ્રસુરિની રચેલં સમરાધુંચ્યકલા
એ એ મહત્વની કૃતિઓનું પણ ભાષાનંતર તૈયાર કરાવો તે અહાર પાડવા આ જરૂરાના

૧ ‘ધર્મભલ’ એ ધર્મભલનું હળવું રૂપ છે. એમકે કાઉસસગનું ‘કાઉસગ’.

૨ આ કૈન દાદિ અતુસારનું પદ્ધતું અથીત રામનું ચરિત્ર છે—રામાયણ છે. એને
પ્રાચીન ૧-૩૨માં પુરાણું કહ્યું છે.

૩ આનું ભાષાનંતર જોવા જાણવામાં નથી એટલે આમ ઉદ્દેશ કરું છું.

३१८]

श्री जैन सत्य प्रकाश

[वर्ष १२

संभालदेतुं हुं साहर ध्यान घेंयुं छुं आ ऐ कृतियोना पछु अमुक अमुक अरै।
डॉलेजना विद्यार्थीयोने अवारनवार शीखवाय छेड़ा भवा तरीके आ वर्षना धन्टरभिजिएटना
विद्यार्थीयोने संभराइच्याकहुनो भीजे भव अने थी. ए. ना प्रथम वर्षना विद्यार्थीयोने
योग्या भव शीखवाय छे. पहेला, भीज अने छट्ठा भवतुं तो अंगेज भाषन्तर थेलुं
छे. विसेषमां समझ कृतिनी झंस्कृत छाया पछु प्राचिक थयेली छे. तो आ सामओनो
हिप्पोग करनारने अभरत कृतिनो गुजराती अनुवाद तेथार करवो सुभम छे. एटले अनु-
वाहक तो भणी रहे तेम छे. तो सभाने आना प्रकाशन मारे वधु नियार करवो पडे
तेम नथी.

पठमचरियना ३३-३५ उद्देसय प्रथम वर्षना विद्यार्थीयो भारे १६४२नी परीक्षातुं
पाठ्य पुस्तक हुतुं एटले एटलो लाग अंगेज अनुवाहाह सहित १६४१मां ऐ त्रय
स्वग्रेथी छपायेहो छे. आवी रीते पहेला चार उद्देसयनो तेमज २७ अने २८माना अंगेज
अनुवाद १६३६ अने १६३४मां अनुक्तमे छपायेल छे.

अगडतानां चरित्र भाषेनां साधनो—

धर्मभविंदीमां धर्मभवत्तु ने चरित्र अपायुं छे तेमां आडकथा तरीके अगडता
झुनिनो आभवतानान्त छे. आना करतां अगडतातुं चरित्र कोई प्राचीन कृतिना अंग द्ये के
स्वतंत्रपछु होय तो ते वात मारा लक्ष्य भहार छे.

उत्तरेक्षयाख्यना ‘असंख्य’ नामना चोथा अनज्यथुमां नीचे सुन्नतुं
छुं पव छे:—

“सुतेसु आवी पडिबुद्धजीवी न विस्ससे पंडिय आसुपन्ने।

घोरा मुहुत्ता अबलं शरीरं भारंडपक्खी व चरडप्पमत्तो ॥ ६ ॥”

‘वाणिज्य’ कुणना, डोर्टके गणुना अने ‘व॒४’ शाखाना गोपालगणि महतरना
शिष्ये हे केमने डेटलाके जिनहाऱ्यमध्ये महतर तरीके एणाभावे छे तेमषे उत्तरेक्षयाख्य
उपर युक्तिशु रथी छे आ युक्तिशुना ११६मा पत्रमां निकाजग्रथुना उदाहरण्य तरीके
अगलुदातनो उल्लेख छे. चोरो सर्व अया त्यारे ए लगतो रब्बो. एवे सभये परिवाजके
आ चोरातुं भरतक कोपी नांयु. परिवाजक अमलुदाता (अमडता) ने कोर्च करा शक्तो
नाह, केमडे ए तो सावध होतो. एनी ऐन पछु अने अपडावी शकी नाह. आ प्रकारनी
हुकीकत अगडताना झंखंखमां आ युक्तिशुमां अपाच छे. [वशेषमां आ दृष्टान्तने लाव
पछु अहो धटावायो छे.]

‘वाहवेताव’ शान्तिसुरिये उत्तरेक्षयाख्य अने एनी निजस्तुतिने अनुलक्ष्याने
“पापाचयटीका” रथी छे. एमां आ प्रथंजेद्वयनिदाना ग्रतिषेधना उदाहरण्य द्ये पत्र २१३आ-
२१५आ-मां अगडतातुं चारत्र आलेखायुं छे. एमां ए उपर्युक्त धर्मभवत्तुं दीनी उभानो
आराध्य छे एटलुं ज नाहि पछु एमां शब्दनी सभानता पछु असाधारण्यपछु दृष्टि-
गोचर थाय छे. तेम छत्ता आ चरित्र धर्मभविंदीनो आधार अपावानो एमा उल्लेख
जेवातो नयी एम प्रा. सांउसरा कडे छे. ने एम न होय तो शुं कोर्च अन्य आधारे
आ चरित्र अपायु हो? अने एम होय तो ए आधार क्यो? छे?

અંક ૧૧] ધર્મલ્લના અને અગડદત્તના ચરિત્રની સામથો [૩૧૬]

પ્રા. સંદેશાંજુએ “મારુંડ” નામનો લેખ લખ્યો છે અને એ “ગ્રન્લાંટ્ઝુ”ના દીપોત્સાહની અંક ૨૦૦૨માં છપાયો છે. આમાંની ડેટલીક ક્ષતિઓનું સ્થયન કરતો અને ડેટલીક વધુ વિભરતો રજૂ કરતો મારો લેખ નામે “લાર્ડ : એક મહાભાગ્ય પક્ષી” અધીંના સાપ્તાહિક “ગુજરાતી મિત્ર તથા ગુજરાત હર્ષણ્ઠ”ના તા. ૫-૧-૪૭ના અંકમાં છપાયો છે. આ તેમજ અષ્ટાપદ વગેરે સંબંધી મારો એક અંગેળ લેખ હાલમાં છપાયો છે. એ ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે.

શાન્તિસુરને ‘વૃદ્ધવાદ’ એવા ઉત્ત્લેખપૂર્વક અગડદત્તનું ચરિત્ર પાઠ્યમાં આપ્યું હૈ. પાઠ્યટીકાના સપાદક મહાયચે આ ચરિત્રની સંસ્કૃત છાયા આપી છે.

દેવ-દ્રગણ્ય ઉર્દે નેમિન-દ્રગણ્યને અણુદિલ્પુર પાઠ્યમાં વિ. સં. ૧૧૨૬માં ઉત્તરાજ્યાણ ઉપર સંસ્કૃતમાં ટીકા રચી છે અને એમાં અનેક કથા આપી છે. તેમાં આ પ્રસ્તુત હતે ૮૪મ-૮૪માં અગડદત્તનું ચરિત્ર પાઠ્યમાં-જરૂરી મરદહીમાં ૩૨૮ પદમાં આપ્યું છે. ધર્મલ્લનિંદોમાના અગડદત્તચરિત્રનિંદાની આથે આ ડોર્ધ ડોર્ધ સ્થળે જુર્દું પડતું જણ્યાય છે અને તેમ હોય તો એ સ્વાક્ષરિક છે, કેમક આ તો ‘વૃદ્ધવાદ’ને આખારી છે—વૃદ્ધિનાં કથનને અનુસ્ઠરે છે એમ નેમિન-દ્રગણ્યને જાતે પ્રારંભમાં હજુ છે.

આ સંસ્કૃત ટીકાનું તેમજ સાથે સાથે એના મૂળનું જીપાદન-કાર્ય જોનાચાર્ય વિજ્ઞયેમંગસુરિજીએ ઈ. સં. ૧૯૭૭માં કર્યું છે.

નૈન સાહિસની અમૃત્ય સેવા બળવનારા જર્મન વિદ્ધાન ડા. હર્મણ્ય યાડોઝીએ Ausgewählte Erzählungen in mahārāstṛī¹ નામની ઇતિ રેમન લિપિમાં સંપાદિત કરી છે. એમાં એમણે ઉપર્યુક્તા ૩૨૮ પદનું અગડદત્ત-ચરિત્ર આપ્યું છે. ને. મેયર (meyer) Hindu Talesમાં એનું અંગેળ ભાષાનતર કર્યું છે અને તેમ કરતી વેગા ડેટલાક સુધારા સુચયા છે. આ જીંસ્કરણનો અને ભાષાનતરનો ઉપર્યુક્ત ડા. પી. એલ. વેદે એમના છ. સ. ૧૬૪૦ની આવૃત્તિમાં કરેલે છે. વિરોધમાં એમણે અંગેળમાં ટિપ્પણી પણ આપ્યા છે. પ્રો. એન. વી. વેદે અને એ. ટો. ઉપાધ્યેયે પણ પેતોતાની આવૃત્તિમાં અગડદત્ત ચરિત્રનું અંગેળ ભાષાનતર વગેરે આપેલ છે. પ્રાકૃત કથા સંગ્રહ (પૃ. ૭૨-૮૭) માં નાગરી લિપિમાં ‘અગડદત્ત’ એ નામથી અગડદત્ત ચરિત્ર છપાયું છે અને એ ડા. યાડોઝીની આવૃત્તાને આખારી છે.

અગડદત્તનું ચરિત્ર પરું પાદનારી ડેટલીક પદાત્મક ગુજરાતી ઇતિએ “નૈન ગુર્જર દવિઓ”નાં નોંધાઈ છે. નેમકે લીલ નામના આવકે વિ. સં. ૧૫૮૪માં અગડદત્તનાસ રચ્યો છે. વાચક કુરુક્ષલાભે વિ. સં. ૧૬૨૫માં અગડદત્ત ચોપાદ (ચરિત્ર), શ્રીસુન્દરે

૧ અહોં અપાયેલા કરકંડુ, નમિ અને નગમધના ચરિત્રો આ વિદેશીકના વિવાચાને કરવાનાં છે, જ્યારે અદી અપાયેલું બંલદત્તચરિત્ર ડાલેજના પ્રથમ વર્ષના વિવાચાનોને શીખવવાનું છે. રેમન લિપિમાં પ્રસિદ્ધ થયેલ બંલદત્તચરિત્ર ગુજરાત પુરાતત્ત્વ મંહિર તરફથી નામરી લિપિમાં વિ. સં. ૧૯૭૭માં પ્રકાશિત થયેલ પ્રાકૃત કથા સંગ્રહ (પૃ. ૨૬૮ પૃ.)માં અપાયેલું છે. ડા. પી. એલ. વેદે કહે છે કે આ પ્રશાસનમાં બધી ભૂલો છે.

४२०

जैन सत्य प्रकाश

[वर्ष १२

वि. सं. ११६६ के पछी वि. सं. ११३६मां अगुडातपाठ, लिखितकीर्तिए वि. सं. ११७०मां अगुडातपाठ, लिखितकीर्तिए वि. सं. ११७८मां अगुडातरास, पुष्पनिधाने वि. सं. ११७०३मां अगुडातपाठ (चरित्र) अने कुल्याणुसारे वि. सं. ११४८ थी १७१८ सूधीना आणामां अगुडातरास, रचेत छे. जिनकुशणना शिष्यज्ञसोमना कोई विषये पछु अगुडातरास रच्ये. छे. आमर्थी कर्त्ता कर्त्ता कृति प्रकाशित थाई छे. मुख्यादि हुक्किकती तपास्त कर्वी आकृ रहे छे.

अगुडातना चरित्रे जैन^१ श्वेतांभर लेखकानु द्वाक ध्यान घेंच्यु छे. अने तेमाना एक लेखक तो जैन गृहस्थ छे.

‘अगुडात’ ऐवु नाम शाथी पड्यु तेनो उल्लेख द्वार्थ स्थग्ने नेवामां आव्यो नथी. ‘अगुड’ ऐवो पाठ्य शब्द छे. एनो एक अर्थ ‘हुवो’ आय छे. यीने अर्थ ‘हुवानी पासे पशुओने पाण्यी पीवा माटे योहलो आडो’ ऐवो आय छे.^२ तीने अर्थ ‘नहि यनावेल’ ऐम छे. आने लक्ष्यमां लेता द्वार्थ हुवानो अधिष्ठायक देव ग्रस्तन थतां पुत्र ग्राप्त थेगो होवाथी ‘अगुडात’ नाम पड्यु होय ऐवी कृपना थाई थेके. जे आ शब्द योगिक ज न होय तो पछी आवी कृपनाने अवकाश नथी.

गोपीपुरा, सुरेत. ता. ६-७-४७

झुवनेश्वर पासे जैन अवशेषो

भूज भंगाणीमां लेखकः—श्री. निर्भलकुमार ध्यसु

अनुवादकः—पूज्य सुर्जनमहाराज श्री शानविजयल (निपुटी)

भारतवर्षमां स्थापत्यनां के जे रथानो छे तेमां प्राचिक झुवनेश्वर पथु एक अने अनेड छे. जमनाबपुरीना यात्रिका लेटली संघ्यामां अहीं जय छे तेटली संघ्यामां आजूराहा के ओसियामां जता नथी. छतां हुःभद लःवे झेवुं पडे छे के आटलो धानिष संभांध होवा छतां झुवनेश्वरना प्राचीन ढंतिहास माटे आपणे धर्मा अज्ञान छीले.

झुवनेश्वरनो विस्तार धमक्षम चार-पांच द्वाश प्रभाण्य छे. जे झुवनेश्वरना विंशराज भन्दिरने भध आनीये तो अग्निध्युषां चार पांच भाक्षिल पर धवलीपहाड छे, ज्यां महाराज अशोकनी शिखाविष्यो. उत्कीर्षु छे. भीजु दिशामां टेटले ज फूर सम्राट आर-वेलना शिखावेषोवाणा. अंडगिरि अने उद्यमिरि भहाडो रहेका छे.^३ आ अने स्थानेमां छ. स. पूर्व त्रीज के भीजु शताभ्दीना स्मरण्या छे. परंतु आ व-तेनी वयमां झुवनेश्वरमां कर्त्ता कर्त्ता कृति पुरातन वस्तुओ भणती नथी. छतां के कर्त्ता भगे के अने जेनो समय निष्कैत

^१ द्वंभर कथा-साहित्यमां अगुडात के धार्मलक्ष्य द्वार्थ चरित्र छे ? वि. सं. ६८६मां हुरिखेले रचेला युहुत्थाकेशामां तो आ ऐमाथी एकत्र चारत्र नथी.

^२ संस्कृतमां ‘अवर’ शब्द छे. जे अने आ अर्थ विवारतां ‘हुवाडो’ शब्दतुं भूज ‘अवर’ होय ऐम जस्ताम छे.

अंक ११]

भुवनेश्वर पासे जैन अभियोगे।

[३२१

करी शकाय छे ते पशु धृष्टिनी नवमी सहीथी प्राचीन नथी. परंतु ऐम पशु जेरथी न कही शकाय के अलीं धृष्टिपदाऽ अने अंडभिरिना समये कँध हुं नहीं. ते समये कँध हुं के नहीं ए संबंधे विशेष शोधभोगनी आवश्यकता छे.

मन्दिरना स्थापत्य संबंधे विचार करीए तो शिल्पशाखाना दृष्टिए रेखमन्दिर के भद्रमन्दिरनी कक्षान्तु आ मन्दिर नथी. विशेष तपासमां नज्जो याय छे के वयमां स्थापित महाकाल शिवलिंगनी उपर ढाकवा भाटे शिल्पभूमि तोडी आ मन्दिर जनावरामां आप्युं छे; ने मन्दिरनुं नाम छे भास्करेश्वर. तेनो रथनाकाळ अशोकस छे, जर्ता अतिहासिक दृष्टिए भीजां मन्दिरो. करतां आ मन्दिर वधारे कीमती छे.

भास्करेश्वर मन्दिरना भव्यमां ६ कूट शिर्युं अने गोरीपट पर ४ कूट पहोणुं शिवलिंग छे, जेनो उपरनो भाग भांडित थयो. ढोय ऐम लागे छे. आश्वर्य तो ए छे के शिवलिंग एक पथरत्न छे, ज्यारे गोरीपट जुदी जतिना पथरनो छे. आ सिवाय गोरीपटनी लंबाई आथे शिवलिंगनी लंबाई पशु भेण आती नथी. आ भाटे राज राजेन्द्रलाल भिन्न तो जख्यावे छे के, प्राचीन कालमां अलीं अशोकनो. स्तंभ होतो कालांतरे तरे स्थाने लिंगरथापना थाई छे अने त्यारपछी तेनी उपर मन्दिर शिर्युं करवामा आप्युं छे.

भुवनेश्वर स्टेशनथी रामेश्वर जर्ता प्रथम रामेश्वर मन्दिर आवे छे. भुवनेश्वर भावहेवनो रथ मन्दिर सुधी आवे छे.

रामेश्वर मन्दिरनी पश्चिमे अशोककुङ्क उपर सारनाथमां रहेक अशोक स्तंभना शिरोभाग जेवो. लाञ्छो भेटो स्तंभ शिरोभाग छे, जेनी उपरनी भूर्तिंओ. नाथ पाभी छे; भाव भूर्तिने ऐक्षाद्वानुं अर्धज्ञाल थाणुं दृष्टिगोचर थाय छे.

x

x

x

उपलब्ध स्तंभशिरोभागथी अनुभान थाय छे के भास्करनो. स्तंभ रक्ष थी ३३ कूट लुधी अत्यारे भागीभाँ (जभीनभाँ) धरभागेदो होवो. जेठिए. तेभज ते समये अत्यारना थरथी ३० कूट नाचे जभीन होवो जेठिए, आ उपरथी ए पशु नज्जी थाय छे के आ स्थानमां उपरना बह्ले नीचेमां विशेष शोध करवी जेठिए अने तेभ करवाथी अतिहासिक विषयमां धृष्टित लाभ थरे.

अग्रे ते आसपासनी जभीन तपासवानु शर क्युं. नीचेना भागभांथी जे वस्तु भगे छे ते उपरनी वस्तुओ. करतां विशेष प्राचीन ढोय ए अमारा ध्याल होतो. परिखामे एक नवो फुवा जेहाता ते स्थानभांथी ए भूर्तिंओ. भण्डा, जेभाँ एक शुद्धेवनी अने थील जैन तीर्थकरनी भूर्ति हुती, ने पैकीनी शुद्धभूर्ति ४. स.नी नवमी सहीनी होवानुं अनुभान छे. विशेष शोध करवामां आवे तो आ जभीनना समान थरभांथी थील पशु वस्तुओ. मणवानो संभव छे.

अशोक स्तंभनी थारे बाजू जोग पाण्डु-अंधन छे, ने आंचीस्तूप तथा लरहूतना पाण्डु अन्धनने भग्नुं छे. आथी भास्करेश्वरनुं लिंग एक समये अशोक स्तंभ होवानुं अनेक रीते नज्जी थाई भयुं छे. पाण्डु-अंधननी पृथग्ये जेहाल भूर्तिंओतुं भठन रथना

४२२]

શ્રી જૈન સત્ય પ્રકાશ

[૧૫૯ ૧૨

માથાની શિખા અને હાથની કૃતિ વગેરે ઉદ્ઘાટિની રાણી ગુણને મળતું છે: એટલે તે સમયનું હોવાનો સંભવ છે. જે બરહૂતની પછી અનેલા હોવાનો સંભવ છે.

મન્દિરની ઉત્તરે કંઈક પશ્ચિમ તરફ વળતાં ડેટલીક બિરિગુંડાઓં છે. તેમાં પણ એ-એક જૈનમૂર્તિઓં જોવામાં આવી. બુદ્ધામાં માટી લારાધ અર્ધ છે. જે તે માટી દ્વારા કરવામાં આવે તો પણ ડેટલું કુઅપૂર્વ જાણવાનું મળે.

અમારા એક મિત્રે એ પણ અખતરો કર્યો અને ધણી પ્રાચીન વસ્તુઓ મેળાની. વિશેષ પ્રયત્ન કરવામાં આવે તો અરોકની પુરાતન રાજ્યાની હોછને અહીંથી પાઠાંબિ-પુત્રની ચેઠે અનેક સત્તો પ્રાપ્ત થશે.

ધવલી અને અંડાભરિ ઉદ્ઘાટિની અધ્યમાં હોના છતાં જીવનેશ્વરમાં પ્રાચીમમાં આવીન નવમી સદીની વસ્તુઓ પ્રાપ્ત થાય છે.

ઉદ્ઘાટિયા અને ઉત્તર ભારતના મન્દિર—વિધાનનો ધર્તિહાસ મેળવીએ તો આ પ્રદેશમાં છ. સ.ની નવમી સદીની વસ્તુઓ મળે છે; તેમજ જીવનેશ્વરનું સ્થાપન્ય પણ નવમીથી બીજી સદીની મધ્યમાં દાખલ કરી શક્ય છે. પરંતુ આવું શિદ્ધ વિધાન ક્યા અધ્યમાં છે વગેરે શોધવાનાં કામો થિલો જ છે.

મહાનદના બન્ને કાઢે સોનપુર, જૌદ, નરસિંહપુર વગેરે રાજ્યોમાનાં પ્રાચીન મન્દિરોની રચના જીવનેશ્વરને મળતી આવે છે.

x

x

x

(અવાસી ૧૯૪૯ વૈશાખ પત્ર ઉપરથી ૪૦ ઉપરથી)

નોટ-મૂળ લેખના પૃષ્ઠ ઉદ્દેશ્યમાં શોકમરતા છીની મૂર્તિ ધારી છે, સંભવ છે કે તે ત્રિશલ્લા રાણી હોય.

જૈન દર્શિન

લેખક:- શ્રીયુત મેહનલાલ હોપચંહ ચોકસી

(કમાંક ૧૪૦ થી ચાલુ)

શુદ્ધસ્થાનકનું સ્વહૃપ વિચારતાં આપણે આર પદ્ધિયાં સુધીની વિચારણા કરી જમા. આપણે એ પણ જેણું કે આત્મા અઠવાનો આરંભ કરે એટલે એ જેમ ઉપરના પગથિયે જય રેમ પમણું કરવામાં આવે તો નીચે પણ અખંડ પડે. અથીત આગળ વધું કે પાછા પદ્ધતું એ પરિષ્વામની ધારા પર મન:પ્રદેશમાં ઉદ્ઘાટના અધ્યવસાય ઉપર અવલંબે છે. તેથી તો છઢી અને જાતમા શુદ્ધસ્થાનકર્મા જગતનાગમનનો સુભાર નથી રહેતો. સમ્બિહ્ન અથવા તત્ત્વજ્ઞાનવાળી ઉપરની ભૂમિકાઓ ઉપરથી અત્યારે ગમાડે છે, લારે ડેવળ મિથ્યાત્મથી બરપૂર પહેલી ભૂમિ પર ન આવતાં થીઝ ઉપર થાબે છે. પ્રથમ કરતાં આત્મશૂદ્ધ કંઈક અંશે વધુ હોય છે છતાં એ ઉત્કાર્ણિતનું ગ્રથાન ન બણી શકાય. એ સ્થાનનો ઉપરોક્ત ઉપરથી પડનાર ઉચ્ચય ભાવેતું થળ શુમાવનાર-આત્મા જ કરે છે. આ જતતું પતન મોહના આવેશમાંથી જન્મે છે. અને આ શુદ્ધસ્થાને રમતા આત્મા મોહની તીવ્ર કાણાયિક શક્તિનો આવિભોવ હોય છે. ભીરતું મિષ્ટ બોજન કર્યો પછી જ્યારે વમન

अंक ११]

जैन धर्म

[३२३

आय त्वारे झेडामां एक प्रकारतो विलक्षणु स्वाद जन्मे छे. तेवीज रीते आत्मानी आस्थानके स्थिति होय छे.

पछ त्रीजनी वात निराणा छे. ए उट्ठाति अने अपहार्ति किंवा अधःपात उल्लभ भाटे सज्जन्य छे. ए स्थाने रमता आत्मामां भाव सम्बद्धिके मात्र मिथ्यादृष्टि न होवाबी चलन-विचलन परिष्वाम होय छे. होंचकानी साहक डोलायमान दशा प्रवर्तती होय छे. आगे आवती हरेकार्ति वात साची भानी लेवा. केवी वर्ता अडों नेरे करे छे. परीक्षा करी पस्तुने सत् के असत् इपे पिछानवानुं थण आ स्थानमां लालतुं नथो. आ स्थान जाओ समय रक्तु नथो. अहींची प्रभतिशील आत्मा परिष्वाम शुद्धिना नेरे आगेवा वधी चोयामां अवेशे छे अने जेथी उक्ती रीते पतनना वमणमां उंधारेव आत्मा सम्बन्धन परंपराने अनुभवतो-अप्यहुतो गगडतो ठेठ पहेले पहेंचे छे.

आम थील अने त्रीजमां-गुण्युस्थान अस्थाता छतां घरेखरी उत्कान्ति नथो. केट्लीक विलक्षणात्मेया छे अने उल्लभ एक सरभा पछु नथो ज.

कमोमां राज्ञ समान भोजने सर्वथा छेद उडी जतां आत्मानी निर्भयता स्फुटिक दत्त सम व्याप्त अणाहणा उडे छे. आरभा गुण्युस्थानमां रमणु कर्ता अने एनी स्थिति पडवाना कथ विहृष्टी थतां अने निर्भयतानी लहरीयो अनुभवतां-लांआ कामयी हाँ-येवी शक्तियो. पूर्णु स्वरूपे भीती उडे छे, अन्य कमोना आवश्यो छिन्नभिन्न थाय छे. एट्लुं नहीं पूर्ण स्वामो याने नायक येवा भोजना नाशयी टपेटप तृक्वा भाडे छे. विकासभामी आत्माना थण सामे ए टडी रहे एतुं सामर्थ्यं न होवाथो अदृश्य थाय छे; सत्तामांथीज अथोत् जउमूलयीज उभडी जय छे के नेथी पुनः प्रगटवानो संभव ज नथो रहेतो. आत्मा परमात्मभानु पूर्णु आध्यात्मिक स्वराज्य प्राप्त उक्ती संविद्यानंह स्वरूपने पूर्णुपछे अंगठावी निरतिशय गःन, द्याँन, याचिन आहिनी संपत्ति भेणनी ले छे, तेमबन अनिर्वचनीय स्वाभाविक मुख्यतो अनुभव उरे छे. ऐम पूर्णुभानी रविन्मे स्वरूप अंदनी संपूर्णु कणायो. प्रकाशमान थाय छे तेम ते उभये आत्मानी भूल शक्तियो. पूर्णु विकासने पामे छे. ए भूमिकानुं नाम तेरमुं गुण्युस्थानक छे. लां लांआ वमत झुधी (आयुष्यनी भयोदा होय ते प्रमाणे) रवा पछी प्राप्त थेवेल संपूर्णु शक्तिनो जन-सम्मुद्रेन लाल आपा पछी आयुष्य आहि चार अधाती कमोना अंतनी नक्षक आत्मा (भद्रात्मा) आवी पहेंचे छे.

ए वेणा आत्मा अजेली होरडी समान अधाती कमोनां आवश्योने उडावी हेडी देवा भाटे सूक्ष्मकियाप्रतिपाती नामा शुक्लध्यानना त्रीज पायानो आश्रय लार्जने भानसिक, वाचिक अने कायिक व्यापाराने जर्वथा राङी नामे छे. ए वेणा आध्यात्मिक विकासनी पराकाढाजे आत्मा पहेंचे छे. आ स्थितिनु नाम योद्दमुं गुण्युस्थानक छे. अनो काळ पांच छास्त्र स्वरना उच्चार नेट्लेवा याने अति अल्प छे. ए अति सूक्ष्मकाढामां आत्मा संमुचित्तिक्याप्रतिपाती नामा शुक्लध्याननो योथो पायो. स्पर्शो सुमेरु पर्वतानी माहक निनक्प रिथिति प्राप्त उक्तीने थरीर त्याज करीने योह राजदोक्ना प्रांत लागे-व्यांथी आगेल अलेक्त छे येवा लोकना अंत लागे-व्यांथी फ्रीझी पाणा आवी संग्रामर्म जन्म

३२४]

श्री जैन सत्य प्रकाश

[पृष्ठ १२]

लेवानो नथी ऐवी कायमी दशामा-स्थित आय छे. आ रीते प्रभति साधतो आत्मा व्यवहार अने परमार्थ दृष्टिये लेखातर स्थान प्राप्त करे छे. ए ज निर्गुण अज्ञ [स्थिति छे; ए ज सर्वांगी पूर्णता छे; ए ज सर्वांशे इतत्रृत्यता छे; पुण्यार्थनी अंतिम सिद्धि छे. आ स्थानने ज अपुनरावृति स्थान तरीके आलेखाय छे. चाहे तो अने सुकृत कहे उक्षिक्षिलानो वास कहे.

अनादि कालथी ज्ञेयेवां अने प्रवाहनी उपमायी अनो भीछे। पठडी घेउर्वा आउ क्वोनो। उद्भूतयी नाश थर्ह चूक्लेवा ढोवायी ज्ञेयेवा धीजमा पुनः अंकुरा उद्भववानो संभव नक्षे ढोतो, तेम अही इरीयी ए क्वो आत्मा उपर काशु ज्ञाने ज्ञेवा उद्भवाव के संभव न ढोवायी संसारमा अवतरवापश्च छ ज नहीं। आत्माने देह नक्षे अने नथी प्राण्-योनि आदि-डेवण अनंतकाण पर्यंतनी स्थिति छे. एटले ज अनंत रान, अनंत दृश्यन्, अनंत सूख अने अनंत वीर्य सिद्धना ल्वोमां द्वेष छे.

भेद कार्य अहारथी आवतो नथी. आत्मानी समय सिद्धनो संपूर्ण आविष्कार-विकासनी पराकाष्ठा-जिङ्गानितनुं अंतिम ५६ एनुं नाम ज भेद. आत्मा सत्करणीना एवे महात्मा अने त्यायी भूमि अद्योनी निर्मलताना जेरे परमात्मा ज्ञने छे. वेदान्तीज्ञानो अदलखाव, शृणु शिव थवुं, के शोक्तुं शृन्यमां भूमि ज्ञवुं ए भवे बिनन नामो होय पञ्च साची वात उपर मुज्ज्य छे. विदेशी अणो. साथे संगीन अण्यो झूझ्या विना ए लाभी शक्य नहीं. तेथी ज शुश्रुस्थाननी अग्रय.

(आलु)

भारत के बाहर प्राकृत का प्रचार

(लेखक—श्रीयुत मूलराजजी जैन, एम. ए., एल-एल. बी.)

आज से पचास बरस पहले कोई कल्पना भी नहीं कर सकता था कि किसी समय भारत के बाहर भी प्राकृत का प्रयोग होता होगा,^१ और वह भी राजकीय पत्र-व्यवहार में। सर आरल स्टाइन (Sir Aurel Stein) के अनवरत अन्वेषण से चीनी तुर्किस्तान जैसे सुदूर देशमें लकड़ी और चमड़े के टुकड़ों पर खरोष्ठी लिपि^२ में लिखे हुए प्राकृत के बहुत

१ यदि चीनी तुर्किस्तानमें कभी जैन धर्म गया होता तो वहाँ प्राकृत के प्रचारकी संभावना थी। देखिये—“भारत के बाहर जैन धर्म” जैन सत्य प्रकाश, जून सन् १९४३, क्रमांक ९३।

२ स्वरोष्ठी एक प्राचीन लिपिका नाम है जो विक्रमसंवत्के तीन चार सौ बरस पहले से लेकर तीन चार सौ बरस पीछे तक गंधार तथा पंजाबमें प्रचलित रही थी। यह दाईं से बाईं ओर को लिखी जाती थी। जैन और बौद्ध प्रन्थोमें इसका उल्लेख मिलता है। चीनी प्रन्थों में इसकी व्युत्पत्ति ‘खरोष्ठ’ से की है क्योंकि इस के अक्षर गधे के होठ की तहर लंबे होते हैं। यह प्रायः प्राकृत लिखने के काम आती थी। इस में स्वरोंका दीर्घत्व प्रकट नहीं

अंक ११] भारत के बाहर प्राकृत का प्रचार

[४२५]

से लेख मिले हैं। इनमें से कुछ लेख लकड़ी के किलाकार टुकड़ों पर हैं और शायद इसी लिये इन लेखों में इन का निर्देश “कीलमुद्रा” शब्द से किया गया है। ये कीलमुद्राएं देश के राजा की ओर से सरकारी कर्मचारियों के नाम लिखी गई हैं। इन में किसी मुकद्दमे अथवा अन्य सरकारी कार्य की चर्चा की गई है।

कुछ लेख लकड़ीके चौरस टुकड़ों पर हैं। इनका नाम “प्रवनक” (प्रमाण, प्रपत्र ?) है। ये एक प्रकार की रसीदें या प्रमाणपत्र हैं जिन्हें अधिकारी व्यक्ति अपने पास रखता था। अनविकारी पुरुष से इनके पाठ की रक्षा करने के लिये इन के ऊपर उसी परिमाण का दूसरा टुकड़ा रख कर उन पर रस्सी लपेट दी जाती थी। फिर रस्सी के सिरे ऊपर बाले टूकडे पर रख कर उनको मिट्टी से ढाप दिया जाता था और मिट्टी पर मोहर लगा दी जाती थी।

इस प्रकार के कुल ७६४ लेख मिले हैं जिनकी रोमन अक्षरों में प्रतिलिपि और अंग्रेजी भाषामें अनुवाद प्रकाशित हो चूके हैं^३। इस प्राकृत का अंग्रेजी में व्याकरण भी बना है परन्तु वह मेरे देखने में नहीं आया। इनकी प्राप्ति की कथा भी बड़ी रोचक है^४।

नीचे इस प्राकृत का नमूना दिया जाता है। इन लेखों के देखनेसे पाश्चात्य विद्वानों के उत्साह, धैर्य और परिश्रमका कुछ अनुमान हो सकता है। जैन मुनियों के लिये प्राकृत के ये लेख अत्यन्त उपयोगी और रोचक सिद्ध होंगे। वे इनके पाठ और अर्थ में कुछ सुधार भी कर सकेंगे।

किया जाता था। हाँ, इस में संयुक्त वर्ण बहुत थे। अभारतीय वर्णों को प्रकट करने के लिये अक्षरों की आकृति में फेरफार कर दिया जाता था, अथवा बिंदु, रेखा आदि लगा दी जाती थी, परन्तु इनही लेखों में एक लेख (नं. ५२३) संकृत में है। इस में स्वरोंका दीर्घव तथा छवर्ण प्रकट किये गये हैं।

३ Kharosthi Inscriptions discovered by Sir Aurel Stein in Chinese Turkestan. Oxford. Part I 1920, Part II 1927, Part III 1929.

T. Burrow : A translation of the Kharosthi Documents from Chinese Turkestan. London, 1940.

४ T. Burrow : Language of the Kharosthi Documents from Chinese Turkestan.

५ Sir Aurel Stein : (1) Ancient Khotan, 2 Vols. (2) Serindia, 5 vols. (3) Innermost Asia, 3 vols. Oxford, 1907, 1921, 1928.

३२६]

श्री लैन सत्य प्रकाश

[वर्ष १२

नमूना॑

कीलमुद्रा नं. १

(ऊपरवाले टुकडे के बाहर की ओर)

चोङ्ग्वो तंजकस् ददव्य

(नीचे वाले टुकडे के अंदर की ओर)

महानुअव महरय लिहति चोङ्ग्वो तंजकस् मत्र देति सु च अहोनो इश लिपेय गरहति यथ एदस् गवि २ सेनिये सर्वचिये अगसितंति एक गवि पतम ओडितंति एक खयितंति एद विवद समुह अनद प्रोछिदव्य यथ धमेन निचे कर्तवो अत्र न परिबुजिशतु हस्तगद इश विस्तुजिदव्य ।

अनुवाद—चोङ्ग्वो तंजक को दी जावेऽ ।

महानुभाव महाराज लिखते हैं । चोङ्ग्वो॑ तंजक॒ को मन्त्रणा देते हैं, और वह इस प्रकार—यहां लिपेय शिकायत करता है कि साच॑० के सैनिक उसकी दो गायों का उठा कर ले गए—एक गाय पीछे लौटा दी, एक (गाय) उन्होंने खा ली । यह विवाद अपने सामने जांचना चाहिये और धर्मानुसार निश्चय करना चाहिये । वहां जो समझ में न आय, उसे यहां मेज देना ।

नं० ५४१

भटरगस्य प्रियदेवमनुष्यसंपुजितस्य योग्य दिव्य वर्षशतयु प्रमनस्य सुनांम-परिकिर्तितस्य प्रचल्छ देवतस्य महंत चोङ्ग्वो तंजकस्य पदमुलमि धोठंघ लिपेय नमकेरो करेति दिव्यशरिर अरोगि प्रेषेति पुन पुनो बहु कोडि शतसहस्रनि अप्रमेगो तेन सुठ पतोस्मि यो तहि परिदे अरोग श्रुयति अहं चिश अरोगेमि तहि प्रा इन एवं च शिरस् विवेमि अहुंनो इमदे स्पस् वंगम भनुश विसर्जिदेमि सुपियन परिदे स्पस् रछनय किं तत्र पदिवति सियति एमेव इश श्रुननय कर्तवो ।

अनुवाद—भट्टारक, देव—मनुष्यों के प्यारे और उनसे पूजित, योग्य—दिव्य—सौ—बरस

६ स्वरों का दीर्घत्व नहीं दिखलाया गया ।

७ यह ऊपर के टुकडे के बाहरका लेख है जो आजकल के कवर (लिफ्टाफे) के एड्स की भाँति है ।

[अंक ११] सिरोही राज्यनां कुटलांक प्राचीन जिनभंहिरे [३२७]

को आयुवाले, सुनाम—परिकीर्तित, प्रत्यक्ष—देवतास्वरूप महम्त चाङ्गबोर्ट तंजक६ के पाद-मूल में घोठंघ^{११} लिपेय^{१२} नमस्कार करता है। दिव्य—शरीर—आरोग्य भेजता (अर्थात् चाहता) है। बार २ बहुत बार, करोड़ लाख बार, असंख्य बार। मैं बहुत प्रसन्न हूँ^{१३} कि आपका सब प्रकारसे आरोग्य सुना जाता है। मैं आपके प्रसाद से यहां स्वस्थ हूँ और सिर छुकाकर यह विनति करता हूँ। मैं ने यहां से सुपियों^{१४} के उपर दृष्टि^{१५} रखने के लिये स्पश—पञ्च—मनुष्य^{१६} अर्थात् चर भेज दिया है कि जो कुछ वहां का समाचार होगा वह वैसा ही यहां मेरे कर्णगोचर किया जाय।

नोट—यदि कोई मुनि महाराज इस प्राकृतका अधिक परिचय चाहते हों तो नीचे के पते से सूचना मिलने पर दो चार और लेखों की प्रतिलिपि तथा अनुवाद भेज दिया जायगा।

जैन विद्याभवन,

६, नेहरू स्ट्रीट, कृष्णनगर, लाहोर (पंजाब)

८ राजकीय पदवी।

९ व्यक्ति विशेष का नाम।

१० साच किसी स्थान विशेषका नाम है।

११ घोठंघ या सोठंघ एक पदवी विशेष

१२ लिपेय = व्यक्ति का नाम।

१३ 'पतो' कदाचित् = सतो = सन्तो? सुष्टु सुन्तो = प्रसन्न।

१४ स्पश = गुप्तचर, दूत।

१५ सुपिय = जाति विशेष।

१६ स्पश = गुप्त भेद लेना, गुप्त दृष्टि।

सिरोही राज्यनां कुटलांक प्राचीन जिनभंहिरे

लेखकः—पूज्य मुनिभद्वाराज श्री न्यायविजयल (निपुटी)

(क्रमांक १४१वी चालु)

डोलार—डोलारनु जैनभंहिरे

पालडीथी दक्षिणां त्रिषु जाउ द्वार आ आम आप्युं छे. सउक छोटीने पगडाने रहते त्वा ज्याप छे. आरे तरह ऐकदा डुंगरा ज डुंगरा नजरे पडे छे; पहाडानु^{१७} ज जाणे साआन्य समझ ल्यो. कुहरते करेली आ अबोव पहाडी हीवालेने भेही आनाणु मुखाहर चालो जम छे त्यारे भरे ज ए विजयी दृष्टिकी नाची भडे छे. मुखाहर आंखा जाणे ओली भडे छे “ज्यां ज्यां नजर झारी हो त्वा त्यां पहाड नजरे पडे.” अभारी

[३२८]

श्री लैन सत्य प्रकाश

[वर्ष १२]

नानकडो संघ कुहरती हृष्यो निहालोता एक पछो एक पहाडोने वरावतो डोलर आवी
पहेंच्यो। अ-यारे त्यां थेठा रथारीआनां धर-गायो भोसो। चरावनारनां झूँपां अने
थेठा मियाखु अहों लसे छे। डोलरतुं पुराणुं नाम 'डोलरगढ' हतुं। आजे एनो डोला
भांडित-धरस्त हैपे जिबो छे। एना क्षुरज अने दरवाज—मुख्य पोल वज्रे हे भाय छे। आजो
आपुं नमर तो कराक काळना विकराज जडामां होमार्छ गयुं छे; नेथी प्राचीन शहेरनुं
नामनिशान नथी रह्युं। भान्र पुराणी धरो अने पाया डवचित् नजरे पडे छे।

अहों एक सुंदर लैन धर्मशाला छे, त्याथी पालण होइ थी ऐ इलोंग द्वार आटीमां
अने पहाड़नी नजुकमां सुंदरतुं भंडिर छे। भंडिरजुमां चेस्तां ज। अंदर प्रथम चोडीनां
आस्वाटियामां सुंदर क्लामय चौह रवनो। डोरेलां छे। निश्वाला भाता सुंदर क्लामय
पक्षमां सुना छे। अर्धं [निर्भित नेत्रकमणे, प्रसन्न हास्य जरतुं मुखारविंद, जाले योइ
रवनो। जेतां मुख उपर थांता विविध इस्तराने दर्शीतुं सुंदर मुखकमल खोली रह्युं छे।
छत्रपद्मं उपर अक्षरे। डोताथी छे:—

महाराजी त्रिशलादेवी चौदेण स्वप्नानि पश्यति।”

चौह स्वप्नां एक ज पाटली उपर डोताथों छे। कम आ प्रमाणे छे। काथी, बणाह,
सिंह, लक्ष्मीहेवी (ऐ भाजु भावत क्षिति हाथीओ। छे अने सुंदर द्वारा अक्षिषेक थहु
रबो छे।) दूधनी भाला, सर्प अने एनी उपर चंद्र, धवज, क्लेश, ज्वरानर अने एनी नाचे
समुद्र एनी नाचे विभान, पछी रत्नराचि अने छेष्टे अभिशाखा।

भंडिरना मुख्य गभारायां भूतनायक्तुं श्री आहिनायक्तुं भव्य सुंदर प्रतिभाष
उपर नाचे मुक्तय लेख छे।

“संवत् १७२१ वर्षे ज्येष्ठ शुद्ध दे रवौ महाराजाधिराज श्री अख्यराजजि (१)
विजयराज्ये 'सिरोही नगरवास्तव्य प्रागवाट ज्ञातीय वृद्धशास्त्रीय मेहाजल भार्या
कल्याणदे सुत सा० (२) कमाभार्या केशरदे पुत्ररन्न सा। उदयभाणकेन श्री
आदिनाथविंव कारपितं। प्रतिष्ठितं वा, तपागच्छोय (३) भ। श्री होरविजयसूरि भ।। श्रीविज-
यसेनसूरि भ।। श्रीविजयतिळकसूरि भ।। श्रीविजयानंदसूरि पट्टप्रभाव (४) का भ। श्री विजय-
राजसूरिभिः ॥

**आवार्थ—संवत् १७२१ ईमां नवेष्ठ शुद्ध दे रविवारे भहाराजाधिराज श्री अक्षय-
राजक्तुं सिरोहीमां राज्य कृता हता त्यारे सिरोही नगरना रडेवासी वीसा पौरवाड**

६. उपर्युक्त सं. १७२१ना लेखवाणी भूर्तिओ। सिरोहीमां अत्यारे पखु विघ्नान
छे। सिरोहीनां धर्म भंडिरार्मा १७२१नी आवनी भूर्तिओ। छे। आमां डेट्वीक भूर्तिओ।
तो। अहु ज भव्य, अने रोनकहारे छे। एक भंडिरमा तो १७२१ना भोटा विश्वाल चोमुख
विंव-चार भूर्तिओ। छे।

७. भहाराज अक्षयराजक्तुं सिरोहीना प्रतापी राज थया छे। तेमनो। सं. १६७४र्मा

अंक ११] सिरोडि राज्यनां केटवांक प्राचीन जिनमंहिदे। [३२६

यातीना भा. (मंत्री) मेधावी, तेमनां पत्ती कलाश्वर्ण तेमना पुत्र सा. कम। अने तेमनां पत्ती देशदेह तेमना सुपुत्र उद्यक्षाणे श्री आदिनाथ अभवाननी भूर्ति—भिंच लशाख्यु अने तपाभ्यर्थीय कहारक (जगहयु) श्री होरविजयसूरि शिष्यरत्न भ. श्री. विजयसेनसूरिज्ञ, तेमना पट्टधर भ. श्री विजयतिकसूरिज्ञ, तेमना पट्टधर श्री विजयनंहसूरिज्ञ, तेमना पट्टधरावक श्री. विजयराजसूरिज्ञये प्रतिष्ठा करावी छे.”

आ लेखमां आवेद आचार्यो प्रसिद्ध हेवाथी छुं तेमनो विशेष परिचय अहो नथी आपतो. वायो, सूरीश्वर ने सभाट, विजयप्रस्ति भक्ताकाव्य अने ऐतिहासिक रास-अंगुष्ठ वर्गेरभार्थी आ महापुरुषोनां चरित्र वाची द्ये तेवी भवामण्यु करी आमण वधुं खुः.

अहो पश्य भूतनायकज्ञी नीचे आचार्य हेवीना स्थाने पहेलां जणाव्या भूत्यां श्री तीर्थंकर हेवनी भूर्ति रथापेक्षी छे. भूतनायकज्ञी जमणी आजु ओ आदिनाथज्ञी भूर्ति छे, परन्तु लेख वज्रेर कार्धिज नथी. शायी आजु श्री अभिनंहन प्रभुज्ञ छे. तेमनी खालांडी उपर नीचे प्रभाष्येनो लेख छे—

“॥ श्रीअभिनंहनविं कारितं प्रतिष्ठितं तपागच्छे श्रीहोरविजयसूरिमिः । १६३२ वर्षे अस्त्र आठहुं ज वंचाख्युं छे.

आ चिवाय अः सुन्दर खातुनी भूर्ति उपर नीचे प्रसाष्टे लेख वंचायै होतो:

“सं. १६६३ वर्षे आषाढ वदि ४ गुरौ श्रीदेवपत्न वासि सोरती (ठी)या जातीय मं. पावा भा, रंभा पुत्रेण मं. राजपाल भारजादेयुतेन श्रेयसे श्रीमुमतिनाथ विं विं कारितं । प्र. श्री तपागच्छे भ. श्रीविजयसेनसूरिपें भ, श्रीविजयदेवसूरिमिः ”

च. १६६३ भा अषाढ वदि ४ ने शुरुवारे देवपत्निवासि (प्रभासपाटशु संभवे छे) सोरतीया ग्रातिना भं. पावा, तेमनां पत्ती रंभा तेमना पुत्र भ. (मंत्री-महामान्य) राजपाले ग्रातानी अी वज्रेना श्रेय भाटे श्री सुमतिनाथज्ञनु भिंच-भूर्ति करावी अने प्रतिष्ठा श्री विजयसेनसूरिज्ञना पट्टाकार श्री विजयहेवसूरिज्ञये करावी.

(सौराष्ट्रमां सोरहिया ग्राति व्यैन हती अनुं आ नवकांत दृष्टान्त छे. सोरहिया जन्म छे; १६७७मां-त्रय वर्षे नी आत्मवये तेमनो राज्याभिषेक थयो छे, अने १७३०मां तेमनो देहान्त थयो छे—अर्थात् तेमना भृत्यु पहेलां नव वर्ष—१७२१मां उपर्युक्त लेखवाला भूर्तिज्ञानी अंजनशक्तास—प्रतिष्ठा महोत्त्व थयेक थे. आ अक्षयराज्ञ महाराव सुरतानना घोत्र थाथ छे. महाराव सुरतान ए ज छे के जेमने श्री होरविजयसूरीश्वरज्ञे उपहेय आपो धर्म आर्जे वाप्या हता. सूरिज्ञना उपहेयथी राज्ये भवमास शिक्षार आदिनो. त्याग छोती होता. आ महारावना आभूष्यी सूरीश्वरज्ञ सभाट अक्षयरत्ने प्रतिष्ठाधीने पाछा वणता अहो यातुर्भास रखा हता. आ राज व्यु ज कठार हिल्नो. अने सज्जत होतो. छताये सूरीश्वरज्ञना उपहेयथी तेना हृष्यन्तु परिवर्तन व्यु हुं. तेम ज अहींना यत्पुर्युध प्रासादमा छे ने १६३४मां जेवें तेमां महाराव सुरतानना नामनो—विद्यमानतानो. उत्तेऽन छे. सूरिज्ञ अने राज्याज्ञने व्यु ज धनिष्ठ संभंध होतो.

(सिरोडि राज्यका धतिहास, ले. गो. डी. ओजाना आधारे अक्षयराज्ञी विजय भेजवी छे).

४३०]

श्री जैन सत्य प्रकाश

[वर्ष १२

ज्ञातिना अनेक महान भावितोऽये अनेक किनमंहिरे वंचाव्या ।, मूर्तिओ भराव्याना लेखा भले छे. अत्यारे पछु ते ज्ञातिमां डेटलाक नैन धर्म पाणे छे भरा.)

अहों भंहिरमां हेरीना भारवटिया उपर पछु लेखा छे. हेरी नं. ५ मां भारवटी भिक्षा संस्कृतमां लेख छे.

“श्री संघजीवो संवत् १७२२ वर्षे” अस आगल नथी वंचातुः.

आ भंहिरमां हमच्चां ज कलाई-सङ्केतो थेयो छे, एमां भारवटिया उपरना हेरीओना लेखा पछु हमाई गया होय ओभ लागे छे.

आ किनमंहिरना पाणिना भाग्यमां-नल्लकमां ज महादेवलुनु भंहिर छे. जैन भंहिरनी कलाई अने आ भंहिरनी कलाई पछु साचे साचे ज थर्ह होय तेम लागे छे.

पाणिन मेटी वाव छे. अथी दूर मेटी पढाई नजरे पडे छे. पढाइ उपर ज्यानो ररतो भाधियो छे. परिचया वोरे साझे जख्याय छे.

आ बाजु जुदा जुदा पाणिया धख्या छे. आमांना डेटलाये पाणिया उपर १७०० अने १८०० ना लेखा छे. डेटलाये युक्त करता करता भप्पी गया छे तेनी नोंध छे. डेटलाक लेखार्हा संवत छे अने डेटलाकमां जंवतो पछु नथी. आ विषयना शेखीन धतिहासविदो आ तरह लक्ष्य आपी, लेखा लर्ह तेमनो विभतवार परिचय डराववानी जडेर छे.

त्यांथा अमे आव्या सिरोडी. पढाइनी वच्ये थधने आ विकट रस्तो काढेलो छे. किरोडीथी ऐ माधव आ तरह साउंसरा महादेवलुं स्थान आवे छे. अहो धख्या पूजा-दीजो. पछु रहे छे. सिरोडीना राजग्रोष्ये आ स्थानने शेवाववा धख्या धख्या प्रयत्नो क्योतुं अमे आंबल्युं, अने नजरे जेवाय पछु छे. तेम ज सिरोडीना रक्षणु मारे पछु आ पढाइ कुदरती अलेघ दीवाल जेवैज छे. दूर दूर रहेला शतुने कुदरनामां पछु न आवे. तेना आववानी डाइने अंधे सरभ्याये आवे हे अहो भेडेलो माध्यस शतुसेनाना आवामनना समाचार सिरोडी पडेंगाडी दृष्ट रक्षणुनी तैयारी डरावी ह्ये छे. तेम ज आवती दृश्मनसेनाने एक वार तो अहों ज थंबावी हेवाय ओटली शक्ति अने ताकात आ पढाइमां आश्रय लधने रहेला सैन्यनां आवे छे.

आ पढाइनां विविध कुदरती दृश्येने नीरभता, वाहानां अने धूपनां विविध रंगी अंत्रो अवलोक्ता अमे सिरोडी आवी पडेंग्या.

सिरोडीनां किनमंहिरेना दूँक परिचय

आ नमर भद्राराव खडसमलज्ज (सेसमलज्ज) ए १४८८मां वसाव्युं छे. सिरोडीना कैन भंहिरे वडु ज प्रसिद्ध छे. एक लाठनिभा एक जयी एकरी उपर अने जयी एकरीमां १४ किनमंहिरे छे. आ आपी भंहिरोनी ज पोल छे. आने हेराशेरी कहे छे. एक बाजु चाउ दूर उंचाखुमां राजमहेल छे. अनी नीचेनी एकरी उपर किनमंहिरे. आवेला-छे. वधां भंहिरोमां सौथी बांचुं, अव्य अने विथाण श्री चतुर्मुख आसाद छे, जेनी स्थापना-अतिष्ठा अं. १६३४मा श्री दीरविज्यसरीश्वरलुओ डरावेली छे. वधु माणतुं आ अव्य भंहिर खूप ज दृष्टीय अने आनंदमह छे. आ सिवाय श्री अक्षितनाथलुनुं भंहिर पछु सुंदर अने विथाल छे. आ भंहिरनी पडेगाई-वंचाई धख्या छे. आवन जिनावयतु आ भंहिर अनुभा

અંક ૧૧] સિરોહિ રાજ્યના ડેટલોક પ્રાચીન જિનમહિરો [૩૩૧

નથે સદાયે નિહાળવાતું મન થાય છે. બને મહિરો બાવન જિનાલયનાં છે. તેમજ શ્રી શંખેશર પાર્શ્વનાથજીનું મંહિર પણ મનોહર છે. મૂર્તિ બહુ જ આકર્ષક અને ભવ્ય છે. આ હેરાણેરીના બહારના વિભાગમાં-પર્મશાળાની પાસેતું શ્રી ભૂરાવલા પાર્શ્વનાથજીને ચિન્તામણું પાર્શ્વનાથજીનું મંહિર પણ સુંદર અને ભવ્ય છે. આમાં શ્રી ભૂરાવલા પાર્શ્વનાથજી મૂર્તિ પ્રાચીન, ભવ્ય અને બહુજલ ચિત્તાકૃતીનું છે. આ મૂર્તિ બહુ જ ચમત્કારી, પ્રાભાવિક અને પરમશાંતિપ્રદ છે. મામ બહાર દાદાવાતીનું શ્રી મહાવીર પ્રશ્નજીનું મંહિર પણ સુંદર શાંતિના સ્થાનમાં આવેલું છે. સિરોહિના મર્મદારોનો તદ્દન દ્વાંક પરિચય નીચે આપું છુંઃ—

૧. શ્રી શાંતિનાથજીનું મંહિર	નેતી સ્થાપના ૧૫૫૧ માં થઈ છે.
૨. શ્રી ચોમુખજી-ત્રણે માળ ચોમુખજી છે	„ „ ૧૬૩૪માં થઈ છે.
૩. શ્રી જોડી પાર્શ્વનાથજી	„ „ ૧૭૮૮માં થઈ છે.
૪. શ્રી શીતલનાથજી	„ „ લગભગ સત્તરમી અઠા- થઈ છે.
૫. શ્રી પાર્શ્વનાથજી (શ્રી શંખેશર પાર્શ્વનાથજી)	„ „ ૧૭૬૬માં થઈ છે.
૬. શ્રી કુંઘનાથજી	„ „ ૧૬૫૩માં „ „
૭. શ્રી મહાવીર પ્રશ્નજી	„ „ ૧૭૬૩માં „ „
૮. શ્રી શીતલનાથજી	„ „ લગભગ સત્તરમી અઠા- થભી સહીમાં
૯. શ્રી આદિનાથજી	„ „ લગભગ પંદરમી-સહીમાં સ્થાપના થયાનું સમાનજી.
૧૦ અજિતનાથજી	„ „ ૧૬૪૪માં
૧૧ ચુંલવનાથજી	„ „ ૧૫૩૪માં
૧૨ નમિનાથજી	„ „ ૧૬૮૩માં
૧૩ શ્રી આદિનાથજી	„ „ પંદરમી-સોળમી સહીમાં

તેર આ અને ત્રણું ઉપરનાં મળી ૧૬ જિનમહિરો છે. આ ચિવાય ત્રણું ચોવીશીનો ભવ્ય મનોહર-પદ, નંદીશર દોપત્રો શ્રી સિદ્ધાંતિરાજનો અને શ્રી ચિદ્ધયાકૃતજીના પદો બહુ જ સુંદર અને દર્શાનીએ છે. બીજા પાંચ તીશીના પદો ચિત્તરેલા પણ સુંદર છે. આ બધા મંહિરામાં ધાતુપ્રતિમાઓ સમેત લગભગ બેથી અઠી હળર (કદાચ વધુ હસે,) પ્રતિમાઓ છે.

ધાતુમૂર્તિઓ પણ પ્રાચીન અને ભવ્ય છે. ડેટલોક પ્રતિમાઓ તો પ્રાચીન ચિદ્ધ-કળાના નમૂના હિપ છે. આચાર્યમૂર્તિઓ લગભગ દોષેક છે. અને શુરુચરણુપાડુકાઓ તો લગભગ પચાસ હસે. મામાં ધાતુમૂર્તિઓ હિપર તો ડેટ તેરમી સહીથી અઠારમી સહી સુધીના લેખો છે. આચાર્યોની મૂર્તિઓમાં પંદરમી સહીથી તે ચત્તરમી સહી સુધીની મૂર્તિઓ છે. ૧૬૫૮ અને ૧૬૬૧ ની જમદારજીની મૂર્તિઓ બહુ જ ભવ્ય અને મનોહર છે. અને શુરુચરણુપાડુકાઓ ડેટ સોળમી સહીથી તે સોળશીલમી સહી સુધીની છે. એક

૮ અહીં ૧૪૬૩-૮૩-૮૭ ના લેખો છે. પણ સમયાભાવે લેખો નથી લેવાયા.

[३२]

ब्रैन सत्य प्रकाश

[वर्ष १२]

महिरभां जीभा काउससगीयानी आधुष्टसुसहितनी सुंदर मे भूर्तिओ। ए मुख्य कुंडल आजु अंध वज्रेत्थी वशूषित ए अहलुत भूर्ति परम दर्शनीय छे।

भूर्तिओना लेखोनां अगे १४८५ अने १४९७ना लेखो जेया, लारपछी सोणभी अदोना पथु लेखो। छे अने अस्तरभी अने अहारमी अहीनी तो पुष्टज्ञ भूर्तिओ। छे आप्त तो, १६०८-९, १६३२, १६३४, १६६१, १७२१, १७३६नी अव्य अनोहर भूर्तिओ। छे आमां प्रतिष्ठापक आ, श्री विजयदानसूरिज्ञ, लग्दृशु श्री हीरविजयसूरिज्ञ, श्री विजयसेनसूरिज्ञ, श्री विजयदेवसूरिज्ञ, श्री विजयप्रभसूरिज्ञ, अहोपाध्याय श्री भेदविजयज्ञ गण्डि वज्रे छे। आप्त १६३४, १७२१, अने १७३६मा अहीं गोटी अंजनशब्दाका थर्ह छोय तेम लेखो। उपरयी समझ्य छे, सप्तसंघान अहाराध्य, भेदभोद्धाध्य, हस्तसंज्ञवनो वज्रे अंधोना अच्छुता चूविहितनाभधेय उपाध्याय श्री भेदविजयज्ञ अश्चिवर प्रतिष्ठित १७३६ना लेखोवाणी भूर्तिओ। आरा लेवासां अहीं ज आवी, भूर्तिओ। अहु ज अनोहर छे।

अहे डोहार्मा आरे आजु धातुभूर्तिओ स्थापित करेली छे। पूज पथु पूरी थती नथी, परन्तु आ, प्रतिभाओ अहार नथी आपता।

आवां सुंदर आविक्षान महिरो, आवी अव्य अनोहर विनप्रतिभाओ। छतां पूजडोनी आमी छे, आरा नम्र अन्तव्य मुजल्य सिरोहीनाशी। संघे ज्यां आस जडी ढोय ज्यां अहींनी प्रतिभाओ। जहर अहार आवावी उचित छे, जेथी आमां बती आशातनाथी श्री, अंधनो अवाव बसे अने तेमने अभ समझो के आरी वस्तुनी सर्वत्र पिण्डाध्य थाय छे।

अहींनी भूर्तिओना लेखो लेवाहुं धाषुं धाषुं अन हु, परन्तु समयाकावे लेखो नथी लर्ह शकाया। परन्तु पू, श्री, शानविजयज्ञ अहाराज्ञना शिष्यरत्न मुनिराज्ञ श्री, वल्लभविजयज्ञने अहींना लेखो लेवानी आप्त भक्षामध्य करी छे, तेओ आ, लेखो लेखो धर्षी धर्षी औतिहासिक विगतो अहार आवशे, सं, १६३४ अने १६४४ना राव सुरताखुना अभयना भेद्या लेज्ञाई के ने महिरना अभारानी अहारना आमभा छे तेमां राव सुरताखुना

६ अहीं सहस्रावधानी आवार्य श्री, मुनिसुंदरसूरिज्ञ पधार्या हुता, तेमज आ, श्री, लक्ष्मीसामरसूरिज्ञ अने आ, श्री, विजयदानसूरिज्ञ पथु पधार्या हुता, तेमज १६१०मा श्री, हीरविजयसूरिज्ञनी आवार्य धर्वी अहोत्सव पूर्वक अहीं थर्ह हुती, १६३२मा पथु श्री, हीरविजयसूरिज्ञ अहीं पधार्या हुता, १६३४मा प्रतिष्ठा अंजनशब्दाका करावी छे, सं, १६३६मा अभाट अहुरने प्रतिभोवपा ज्यां अहीं पधार्या हुता, अने रावसुरगायने उपहेय आप्तो हुता, आ, वप्ते तेमना पट्टधर आ, श्री, विजयसेनसूरिज्ञ पथु अहीं सुधी साथे हुता, अने अहीं आ प्रसंजे छेल्वी वंडना करी अहींथी अंभात तरह पधार्या हुता, अने श्री, हीरविजयसूरिज्ञ भेवातहेय तरह पधार्या हुता; इतेपुरसिकी पधार्या हुता, आ श्री, विजयसेनसूरिज्ञ अंभात ज्याने सुप्रसिद्ध दानवीर धर्मवीर शेष वाज्या राज्याना महिरभां आ ज समये गोटी अंजनशब्दाका अने प्रतिष्ठा अहोत्सव कराव्या हुता।

અંક ૧૧] સિરોહી રાજ્યનાં ડેરલાંક પ્રાચીન જિનમહિદી [૩૩૬

શુલ કાર્યોની અને જગ્યાયુદ્ધના સફુપહેથની વિગતવાર નોંધ છે, જે બદ્ધ જ ઉપરોગી છે. તેમજ જુદા જુદા અચ્છોની પણ જુંદર નોંધ મળરો. આ અધિય અચ્છોએ જેન શાસનની પ્રભાવના માટે કરેલાં શુલ કાર્યોની નોંધ આપણું-નૈન ધર્મને ઔરવપ્રદ નીવડ્હે અને હું ધારું હું.

આ જ્ઞાનાય અહીં પોષાંદો પણ ધારું છે. અત્યારે તો વષુ મોટા ઉપાશ્રય-છે. હમજું આધુસાખીઓના પછી પાઠન નિયમતે સંસ્કૃત પાઠ્યાળા પણ ખૂલ્લી છે. જુંદર ધર્મશાળા છે. યાત્રિકા માટે આરી વ્યવસ્થાવાળી બોજનશાળા છે. યાત્રિકોને દરેક જાતની સંગ્રહ આપવા માટે પ્રયત્ન આદે છે.

અહીં એક જુંદર નૈન ધાર્મિક શિક્ષણ આપે તેવી પાઠ્યાળાની જરૂર છે. માતાઓએ અને બહેનોને ગાન આપે અને ભવિષ્યના જેન સંધના નેતાઓને ધાર્મિક ગાન, ધાર્મિક સંસ્કાર અને ધાર્મિક અભ્યાસ વિના નહિં ચાલે. કિરોહી સંધે આ માટે જરૂર પ્રયત્ન કરવાની જરૂર છે.

શ્રી. હોરાવજ્યસુરીશ્રી અભ્રાટ અકબરને પ્રાતિયોધોને પાણ વળતાં સિરોહી નરેશ શ્રી. સુલતાનજુના આમણ્યી સિરોહીમાં ચાતુર્માસ રબા હતા. અને શ્રી. સુલતાનજુનાએ પણ સુરિણા ઉપદેશથી પ્રજા ઉપર વતારે કર ન નાંખવા અને અમારી પણવાનું સ્વીકાર્યું છે. સુરિણા આ ચાતુર્માસમાં ધારું ધારું ધાર્મિક શુલ કાર્યો થયેલાં છે. આ સુલતાનજુના અમયમાં જ સિરોહીના એ મોટા ભાવ્ય નિયમહિદો બન્યાં છે, જેનો મોટા શિવાલેખ પણ વિવભાગ છે. સુરિણા ઉપદેશથી સુલતાનજુનું મન કુણું થયું હતું, કદ્યમાં દ્વારા ધર્મ ઉપર બદ્ધ જ ગ્રેમ જાગ્યો હતો. આશ્રી. વિજ્યસેનસુરીશ્રી જ્યારે અહીં પદ્ધાર્યાં સુલતાનજુના સુરિણાની સામે અચ્છો છે અને સુરિણાને બદ્ધ જ આદરસંકાર કર્યો છે.

ત્યારપણી તેમના પૌત્ર અભ્યાસ રાજુના જન્મયમાં શ્રી. વિજ્યસેનસુરીશ્રી સિરોહીમાં ચાતુર્માસ રબા છે. આ વખતે સાદરીમાં દુંકામતવાળાઓએ તપામચ્છીય શ્રાવકોને બદ્ધ જાતાયા હતા. આદરીના શ્રાવકોએ સિરોહી આવી શ્રી. વિજ્યસેનસુરીશ્રી પાસે ઇરિયાદ કરી અને જણાયું કે આપના જેવા પ્રતાપી ચાસનનાયક હેવા છતાં અમારી આવી રિયાત થાય તે ઉચ્ચિત નથી. એટલે સુરિણાએ ગીતાર્થ ચાંદુઓને આરી મોકલ્યા છે. ગીતાર્થોએ આરી જર્દ દુંકાઓને મોન કરી દીખા; ચાતુર્માસ પછી મેનાનરેશ રાખ્યા કર્યાચિહ્ન પાસે ઉદ્ઘાસુર જર્દ લ્યાની રાજસભામાં વિદ્ધાને સમક્ષ દુંકાઓ સાથે શારખાર્દ કરી તેમને દરાંયા અને તપાઃ સત્યા લુઙ્કાશ્વાસત્યા: "તપા સાચા છે જાને દુંકાઓ અખત્ય છે, આવું વિજ્યપત્ર મેળવી સાદરી પાણ આંધ્યા, અને એ વિજ્યપદ્ધતિ વાંચી સંલાયો. પછી સિરોહી આવી સુરિણાને બરણે પદ્ક ખ્યો. સાદરીમાં તપામચ્છીય શ્રાવકોને ખૂબ જ મહિમા દેવાયો. (પદ્કાન્ધી સમુદ્ધ્યયના આધાર). આવી રીતે સિરોહી નમર તો ધારું વધે સુધી સુવિલંબ થાસનનીપછ અને મહાપ્રભાવિક આચાર્યનું વિહાર-શૈત્ર અને ધર્મપુરી રહ્યું છે. એટલે જ એનો "શિવધૂરી" તરીકેનો ઉલ્લેખ જેવાય છે. સિરોહીમાં શ્રી. હોરાવજ્યસુરિણાની દાદવાહી પણ ગામ બહાર છે. તેમજ સુરિણાની એતનું ભાવ્ય ભૂર્તાઓ પણ છે. આ રીતે સિરોહીમાં સુરિણાનું સ્મારક અત્યારે પણ જીવત-રૂપે વિવભાગ છે.

४४४]

श्री लैन सत्य प्रकाश

[वर्ष १२]

अहोना बुवडा उत्साही, धगथावाणा अने सेवाकारी छे. परन्तु धार्मिक संस्कार, [संस्कृत अने अध्यात्मनी पूरी जडर छे.

अहो लैन पुस्तकालय पत्र चाले छे. ग्रानथांडार पत्र छे. सिरोहीनी आरे तरह पढाडा आवेदा छे. अहोना श्रीमंत धर्मदीर अने दानवीर लैनेए सिरोही राज्यमां लैन भांहिरा बंधावो राज्यने शोभाभ्युँ छे. तमे कौष्ठ पत्र आमर्मा जाओ, गोटामागेहुँ अने सारामांकारुँ भांहिर के मडान जूँयो. तो चोक्स समजले के ए लैन भांहिर के लैन उपाख्य छे. आप्या राज्यभरमां लैनेनां मडानो ज थांचां अने थिंक्लाँ छे. लैनेनी आ उदार धर्म आवानानी अखर आ प्रहेतानी अलैन जनता उपर पत्र बध छे अने पढाडामां शिवालयो, हेवालयो, हेवस्थानो बंधाव्यां छे. तेम ज आ प्रहेताना लैनेए पत्र घूँय ज उदारताथी अमां सहायता महू आपी छे. सिरोहीमां डैट-बांड राज्यनां मडानो वज्रे जेवा लायक छे. राज्यमां उच्च अधिकारीयो पत्र लैनो छे.

सिरोहीतुँ वर्षुन समाप्त कड़ ते खेडां सिरोहीना भांहिराना वर्षुनना प्राचीन कविमाना उल्लेख आपुँ ते अनुचित नवी ज. जूँयो—

“ सिरोही सहस्र श्री पास मनहतयी अखिं पूज्य आस ” — (कवि भेद)

“ प्रतिभा अडावीश ते प्रख्युमर्झ शिवपुरनगरि रे निवास

भांहिर धग्यारि सहिस च्यार शुं एडातरि सुविलास ”

— (चैत्यपरिपाठी आगमगच्छपति भिक्षिमारचित)

जिव्युर-अयोत, सिरोहीमां अभियार भांहिर छे अने चार हजार ने एडातेर (४०७१) भूर्तिओ ढेवानु लघे छे. कविराजे त्यानी अधी धातु भूर्तिओने पत्र भेगी गेहेशी हो.

— (पार्श्वनाथ चैत्यपरिपाठी पं. श्री कृत्यायुसागरज)

“ सुषकारी सिरोहिये पठिएहियेरे वंडु अपभल्लुँ ”

— (सौभाग्यविज्ञविरचित तीर्थभाषा)

“ नयर सीरोही उत्तमगम हेउल दीपे भिक्षिमाधाम

आहि अज्ञत ग्रासाह उत्तंभ ऊरजिलो संभेक्षरो भनिरंग

अपभल्लेवयोमुभि चोसाल दीपे इरिस्थु अभीच रसाल

ग्रंट भत्त्व गेववाहमाहि संधीवी सीपासु इडिवाय ”

— (कवि शीदाविज्ञविरचित तीर्थभाषा)

* * * * *

धुमि सीरोहि नगरें आवीया जनम कृतारथपत्र लविया

आहि चेळ दीडुँ उद्धाम लेहनो रवर्म अमेवडि शाम

चृष्टुभ चैत्य त्रिभूमिक भलो अज्ञत शांति कुँयु ऊनहर गुणनिलो

श्रीगुराहगिपास प्रसिद्ध विविध चैत्य यात्रा तिहाँ शाख

देहराँ तिहाँ उत्तंभ धग्यार भेटी शीध सहस्र अवतार

भें ले भांहिरेतुँ वर्षुन क्युँ छे तेवुँ ज आमां छे. आ कविना समये अगीयार भांहिरा हतां. — (आ. श्री गुनविभृत्यसुरिल तीर्थभाषा)

अत्यारे १६ जिनमभांहिरो छे अने धातुभूर्तिओ. वज्रे अधुँ अवीने भाव फैल भूर्तिओ होरी.

भांहिराना दर्शन करी, ‘क्यों सहस्र अवतार’ अम भाविक सुभुक्षुने जडर बाजे छे. (आहु)

श्रीजिनप्रभसूरिकृतं आत्मसम्बोधकुलकम् ।

सं.-पूज्य मुनिमहाराज श्रीकान्तिविजयजी

मोक्षसुकरे सया मोहं अमोहं जाण सासणे ।

तेसि कथपणमो हं सम्बोहं अप्यणो करे ॥ १ ॥

दसहि चुष्टगाईहिं दिदृन्तेहिं कयाइ उ ।

संसरंता भवे सत्ता पार्विति मेणुयत्तणं ॥ २ ॥

नरते आरियं खेतं खेते वि विमलं कुैलं ।

कुले वि उत्तमा झाई जाईए रैवसंपया ॥ ३ ॥

रुवे वि [अ] अरोगतं नीरोगे चिँरजीवियं ।

हियाहियाइर्विनाणं जीविए खलु दुष्टहं ॥ ४ ॥

सद्घम्मसंबणं तम्मि सवणे धींरणं तहा ।

धारणे संदहाणं च सदहाणे वि संजैमो ॥ ५ ॥

एवं रे जीव ! दुळभं बारसंगाण संपयं ।

संपयं पाविऊणोह पमाओ नेव जुज्जए ॥ ६ ॥

पमाओ य जिर्णिदेहि अट्हा परिवन्निओ ।

अंनाणं संसैओ चेव मिछ्छानाणं तहेव य ॥ ७ ॥

रैगदोसो मईैमंसो धम्मंमि य अंणायरो ।

जोगाणं दुष्पणीहाणं अट्हा वजियव्वभो ॥ ८ ॥

वरं महाविसं भुतं वरं आगीपवेसणं ।

वरं सत्तूहिं संवासो वरं सप्पेहिं किलियं ॥ ९ ॥

मा धम्मंमि पमाओ जमेगमच्चू विसाइणो ।

पमाएणं अणंदाणि जम्माणि मरणाणि य ॥ १० ॥

चउदसपुव्वीधाहारगा वि मणनाणवीयरागा वि ।

हुंति पमायपरवसा तयणंतरमेव चउगइया ॥ ११ ॥

सगापवागमग्गंगि लगा वि जिणसासणे ।

पाडिया हा ! पमाएणं संसारे सेणियाइया ॥ १२ ॥

सोढाइं तिक्खदुक्खाइं सारिरमाणसाणि य ।

रे ! जीव ! नरए धोरे पमाएणं अणंतसो ॥ १३ ॥

दुक्खाइं जेगल्क्खाइं छुहातप्हाइयाणि य ।

पत्ताइं तिरियत्ते वि पमाएणं अणंतसो ॥ १४ ॥

रोगसोगविभोगाइ रे ! जीव ! मणुयत्तणे ।

अणुभूयं महादुक्खं पमाएणं अणंतसो ॥ १५ ॥

३३६]

श्री ज्ञेन सत्य प्रकाश

[वर्ष १२

कसाया विसया ईसा-भयाइणि सुरत्तणे ।

पत्ते पत्ताइं दुक्खाइं पमाएणं अणंतसो ॥ १५ ॥
जं संसारे महादुक्खं जं मुक्खे सुक्खमक्खयं ।

पार्विति पाणिणो तथ पमाया अपमायओ ॥ १७ ॥
पत्ते वि सुद्धसम्मते सत्ता सुत्तनिउत्तया ।

उवउत्ता जं न मग्गमि हा ! पमाओ दुरंतओ ॥ १८ ॥
बाढं पढंति पाढंति नाणासत्थविसाया ।

भुल्लंति ते पुणो मग्गा हा ! पमाओ दुरंतओ ॥ १९ ॥
अन्लेसि दिंति संबोहं निसंदेहं द्यालुया ।

सयं मोहहया ते वि हा ! पमाओ दुरंतओ ॥ २० ॥
पंचसयाण मञ्जिंमि खंदगायरिओ तथा ।

कहं विराहओ जाओ हा ! पमाओ दुरंतओ ॥ २१ ॥
तयवत्थं तया हूओ सुङ्गदेवेण बोहिओ ।

अज्जसाढगणी कटुं हा ! पमाओ दुरंतओ ॥ २२ ॥
सूरी य महुरामंगू सुत्तत्थधरो थिरं ।

पुरनिद्धमणे जक्खो हा ! पमाओ दुरंतओ ॥ २३ ॥
जं हरिसविसाएहिं चित्तं चिन्तिज्जए फुडं (कूडं) ।

महामुणीण संसारे हा ! पमाओ दुरंतओ ॥ २४ ॥
अप्पायत्तं कयं संतं चित्तं चारिचसंगयं ।

परायत्तं पुणो होइ हा ! पमाओ दुरंतओ ॥ २५ ॥
एयावत्थं तुमं जाओ सब्बसन्नो गुणायरो ।

संषयं पि न उज्जुतो हा ! पमाओ दुरंतओ ॥ २६ ॥
हा ! हा ! कहं तुमं होसि पमायकुलमन्दिरं ।

जीव ! मुक्खे सया सुक्खे किं न उज्जमसी(सि) लहुं ॥ २७ ॥
पावं करेसि किच्छेण धम्मं सुक्खेण नो पुणो ।

पमाएणं दुरंतेण कहं होसि न याणिमो ॥ २८ ॥
हा ! हा ! महापमायस्स सब्बमेयं वियंभियं ।

जं न सुणंति पिच्छंति कन्नदिष्टीजुया वि हु ॥ २९ ॥
सेणावई मोहनिवस्स एसो सुहाण जं विग्घकरो दुरप्पा ।

महारिकं सब्बजियाण एसो अहो । हु कटुं ति महापमाओ ॥ ३० ॥

जहा पयदृंति अणज्जकज्जे तिहा वि निच्चं मणसा वि नूर्ण ।

तहा खणेगं जइ धम्मकज्जे ता दुक्खिखओ होइ न कोइ लोए ॥३१॥

जेणं सुलद्वेण दुहाइ दूरं वयंति आयंति सुहाइं नूर्ण ।

रे ! जीव ! एयंमि सुहालयंति जिणिदधम्मंमि कहं पमाओ ॥ ३२॥

एयं वियापिऊगं मुंच पमायं सया वि रे ! जीव !

पाविहिसि जेण सम्म जिणपहुसेवाफलं रम्म ॥ ३३॥

आत्मसम्बोधकुलकं समाप्तम् ।

આ ‘आत्मसम्भोधकुलક’ पाठथना भेतरवसीना પાડાના તાડપત્રના અંતારની (૩૧. નં. ૬ પૃ ૬૬ થી ૬૮) પ્રતિ ઉપાથી ઉત્તરીને અહો આપ્યું છે.

श्री संघने विश्वप्ति

सभिति अने भासिकने सहायता करो !

पर्वाधिराज पर्युषिणु महापर्व आવे છે, તે પ્રસંગે મુનિસમ્મેલને સ્થાપન કરેલી આ સભિતિ અને એ સભિતિના સુખપત્ર આ ભાસિકને વધુમાં વધુ મહદ આપવાની અમે સમસ્ત શ્રી સંઘને વિશ્વપ્તિ કરીએ છીએ.

अત્યારની કારમી મૌંઘવારી અને અતિ વિષમ સંઘોળો છતાં શ્રીસંઘના પ્રેમકાર્યા સહિય સહકારથી સભિતિ પોતાનું કામ નિયમિતપણે જારી રાખી શકી છે અને ‘શ્રી જૈન સત્ય પ્રકાશ’ ભાસિકનું પ્રકાશન નિયમિતપણે ચાલુ રાખી શકી છે. અને અતિ અદ્વય મૂલ્યમાં એ જગતાને સાહર કરી શકી છે.

अત્યારના આડરા સમયમાં સભિતિને નાલ્યાંની સવિશેષ જરૂર છે એ જીના નરક અમે શ્રીસંઘનું નન્દ ભાવે ધ્યાન હોટોએ છીએ. આ સભિતિ અને આ ભાસિક સમસ્ત શ્રીસંઘનાં પોતાનાં જ સંતાનો છે, એટલે એની સહાયતા ભાટે અમારે વિશેષ કહેવા-પણ ન હોય.

સૌ કોઈ એની સહાયતા કરવાનું યાહ રાજે એ જ વિશ્વપ્તિ

શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સભિતિ
જૈશિગલાઈની વાડી, ધીકાંટા, અમદાવાદ.

Shri Jaina Satya Prakasha. Regd. No. B. 3801 श्री जैन सत्य प्रकाश.

हरेके वसाववा योग्य

श्री जैन सत्य प्रकाशना नये विशेषांक।

(१) श्री महावीर निर्वाणु विशेषांक

लगवान् महावीरस्वामीना ज्ञवन् संबंधी अनेक लेखाथा
समृद्ध अंकः मूल्य छ आना (टपालभर्तो एक आने वधु).

(२) हीपोत्सवी अंक

लगवान् महावीरस्वामी पर्यानां ३००० वर्ष पश्चीनां सातसो वर्षाना जैन
छतिहासने लगता लेखाथी समृद्ध सचिन अंकः मूल सवा इपियो.

(३) कुमांक १०० : विक्रम-विशेषांक

समाप्त विक्रमादित्य संबंधी जैतिहासिक लिङ्गलिङ्ग लेखाथी
समृद्ध २४० पानाना दण्डार सचिन अंकः मूल ढाई इपियो.

श्री जैन सत्य प्रकाशना ये विशिष्ट अंके।

[१] कुमांक ४५-जैनदर्थनमां मांसाद्वार डेवाना आसोपेना
ज्वालादृप लेखाथी समृद्ध अंकः मूल्य चार आना.

[२] कुमांके ४५-क. स. श्री डेमचंद्राचार्याना ज्ञवन् संबंधी
अनेक लेखाथी समृद्ध अंकः मूल्य त्रियु आना.

काची तथा पाड़ी इधरले

‘श्री जैन सत्य प्रकाश’नी गीत, गोथा, भाग्यमा,
आठमा, दसमा, अगियारमा वर्षोंनी काची तथा पाड़ी इधरले। तैयार छे.
मूल्य हरेकतु धनीना ये इपिया, पाड़ीना अदी इपिया.

— लेखा —

श्री जैनपर्म् सत्यप्रकाशक समिति
ज्ञेशिंगलार्जनी वाडी, धीकांडा, अमरावती.

मुद्रकः—मगनबाई ग्राटोबाई हेसाई. श्री वीरविज्ञ्य प्री-टीज प्रेस, सलापोस होसरोड.
फै. नो. न. १ श्री अक्तिमार्गी कार्यालय-अमरावती. प्रकाशकः—श्रीमनलक्ष्म गोप्तवास शास.
श्री जैनपर्म् सत्यप्रकाशक समिति कार्यालय, ज्ञेशिंगलार्जनी वाडी, धीकांडा रोड-अमरावती.